

41

# આરોગ્યની ચાવી

ગાંધીજી

GANDHI BOOK CENTRE  
Bombay Sarvodaya Mandal,  
299, Tardeo Road, Nana Chowk,  
Bombay 400 007.  
Phone : 3872061, 3872060



નવજીવન પ્રકાશન મંદિર  
અમદાવાદ - ૩૮૦ ૦૧૪

આર ઇન્ડિયા

® નવજીવન ટ્રસ્ટ, ૧૯૪૮

પહેલી આવૃત્તિ, સન ૧૯૪૮ : પ્રત ૧૦,૦૦૦  
અગિયારમું પુનર્મુદ્રણ, પ્રત ૫,૦૦૦, નવેમ્બર, ૧૯૬૬  
કુલ પ્રત : ૧,૨૭,૦૦૦

ISBN 81-7229-061-6

મુદ્રક અને પ્રકાશક  
જિતેન્દ્ર ઠાકોરલાઈ હેસાઈ  
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

## પ્રકાશકનું નિવેદન

ગાંધીજીની આ નાનકડી ચોપડીનો મજેદાર ઈતિહાસ છે; જેનું હુકમાં કથન તેઓશ્રીએ પોતે જ આ ચોપડીના 'પ્રાસ્તાવિક' પ્રકરણમાં કર્યું છે.

એમાં કહ્યા પ્રમાણે, આ ચોપડી આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન નો નવે હોણે અવતાર છે," એમ કહી શકાય. તેઓશ્રીએ આ ચોપડીનાં પ્રકરણ ઈ. સ. ૧૯૪૨-૪૩ના જેલનિવાસ દરમિયાન લખ્યા હતાં. અને પુસ્તકનું લેખનકામ ઉકેલવાને માટેની એમની સામાન્ય પહૂંચિ પ્રમાણે, રોજ ચોંકું ચોંકું કરીને તે કામ પૂરું કર્યું છે. પુસ્તકમાં તે તારીખો ઉતારી છે.

આ તારીખો પરથી જણાશે કે, આ ચોપડી ૧૮-૧૨-૪૩ના રોજ પૂરી થઈ હતી. તો પછી તે આટલી મોડી અને એમના ગયા બાદ કેમ બહાર પડે છે? તેનું કારણ કહેવું જોઈએ. ગાંધીજીને મન, તેમના આ લખાણનો વિષય એટલો મહત્વનો હતો કે, તે અને પ્રસિદ્ધ કરવામાં થોભવાનું પસંદ કરતા. તેમને મન આરોગ્ય એક યોગ-સાધના જ હતી, એમ કહેવામાં કાંઈ ખોંકું નથી. ઈ. સ. ૧૯૪૨થી તેઓ આ લખાણને પોતાની પાસે રાખતા અને નવરાશ પ્રમાણે ફરી ફરી જોતા રહેતા. રોજ વધતા જતા પોતાના અનુભવનો છેવટનો નિયોડ એમાં આપી શકું તો કેવું સારું! - એમ એમને થતું હું એ ચોપડી છાપવા માટે અનેક વાર એમને પૂછતો; પણ તે પોતાની વૃત્તિને વળગી જ રહેવાનું પસંદ કરતા. આથી છેવટે તે ગયા પછી જ હું એ લખાણનો હાથલેખ મેળવી શક્યો.

મૂળ તેમણે ગુજરાતીમાં લખ્યું. જેલમાં જ એનો અંગેજુ તથા હિન્દુસ્તાની, અનુવાદ તૈયાર કરાવી પોતે જોઈ ગયા. એમને મન આ ચોપડી કેટલી ડીમતી હતી એનુંય સૂચક આ ગણાય. આનું કારણ છે - ગાંધીજીને મન શરીર અને તેનું આરોગ્ય ભોગ કે ઈદ્રિયારામની વસ્તુ નહોતું. પણ માનવજીવનની સકળતાનું ઈશ્વરે બક્ષેલું સર્વोત્તમ સાધન હતું. અને એની સકળતા એ વડે ઈશ્વર અને તેની સૂચિની સેવા કરવી, એ હતી. આ કરવાને માટે શરીર તેનું આધ સાધન છે. તેથી તેકેવી રીતે સાખૂત રાખવું, તે વિશેની આ અનુભવ-પૂત ચોપડી ગાંધીજીની લખેલી પહેલામાં પહેલી અને છેલ્લામાં છેલ્લી આપણને બેટ છે. એમના જીવનને યાદ કરીને ચાલવામાં એ સહાય આપણને પેરો.

## અનુકમણિકા

પ્રકાશકનું નિવેદન .....	૩
વિષયસૂચિ .....	૫
પ્રાસ્તાવિક	૧૨
	ગાંધીજી

## ભાગ પહેલો

૧. શરીર .....	૧
૨. હવા .....	૪
૩. પાણી .....	૬
૪. ખોરાક .....	૭
૫. મસાલા .....	૧૭
૬. ચા, કોકી, કોકો .....	૧૮
૭. માદક પદાર્�ો .....	૨૦
૮. અદીણ .....	૨૩
૯. તમાકુ .....	૨૫
૧૦. અન્યાન્ય .....	૨૭

## ભાગ બીજો

૧. પુઢવી એટલે માટી .....	૩૪
૨. પાણી .....	૩૬
૩. આકાશ .....	૪૭
૪. નેજ .....	૫૦
૫. વાયુ - હવા .....	૫૨

# વિષયસૂચિ

## ભાગ પહેલો

૧. શરીર

૧-૪

તંકુરસ્ત શરીર ૧  
 રોગી-મલ્લ શરીર ૧  
 દશ ઈદ્રિય ઉપર શરીરનો વહેવાર ૨  
 અગિયારમી ઈદ્રિય ૨  
 શરીર - જગતનો નમૂનો ૨

ઇદ્રિયોની ચુખાકારીનો આધાર ૩  
 અપચો, બંધકોપ ૩  
 શરીરનો ઉપયોગ ૩  
 આત્માનું મંહિર ૩  
 મળમૂત્રની ખાણ ૩  
 સેવાધર્મ અર્થે શરીર ૪

૨. હવા

૪-૬

હવા ૪  
 પ્રાણવાયુ ૪  
 ઘર કેવાં જોઈએ? ૪  
 મોટેથી હવા લેવી ૪  
 નાકથી હવા લેવી ૪  
 પ્રાણાચામ ૫  
 નાકની સકાઈ ૫

નાકમાં પાણી ચડાવવું ૫  
 ખુલ્લામાં સૂલું ૫  
 કેવી રીતે ઓઠવું? ૫  
 રાતનો પહેરવેશ ૫  
 દિવસનો પહેરવેશ ૫  
 આસપાસની હવા ૬  
 જગ્યાની પસંદગી ૬

૩. પાણી

૬-૭

પાણી ૬  
 કેટલું પ્રવાહી લેવું જોઈએ? ૬  
 કયું પાણી પીવું? ૭  
 નદીઓ તથા તળાવોનાં પાણી ૭

પાણી અને આરોગ્ય ૭  
 ઉકાળેલું પાણી ૭  
 ધર્મ અને પાણી ૭  
 ગાળેલું પાણી ૭  
 ગળાયું કેવું જોઈએ? ૭

૪. ખોરાક

૭-૧૬

મનુષ્યનો નિર્વાહ ૭  
 ખોરાક કેટલી જાતના? ૭  
 માંસાહાર કયો? ૭

કૂધ કયા આહારમાં? ૮  
 સજીવ ઢીડાં ૮  
 નિર્જીવ ઢીડાં ૮

દૂધ અને નિર્જવ ઈડાં (એક જત) ૮	ભૂસીવાળો આટો ૧૧ ભૂસીના ગુણ ૧૧ ચાવલનું ઉપરનું પડ ૧૧ ચાવલ કેટલી હે ખાંડવા? ૧૨ ચાવલમાં ઈયળ પડવાનું કારણ ૧૨ ચાવલની ભૂસી કીમતી વસ્તુ ૧૨ ચાવલની રોટલી ૧૨ દાળ શાકમાં બોળેલી રોટલી ૧૨ ચાવીને ખાવાના કાયદા ૧૨ કઠોળ ૧૨ દાળ વિનાનો ખોરાક ૧૨ દૂધ અને દાળ કોણે માટે? ૧૨ દાળ ભારે ખોરાક ૧૩ માંસાહાર અને દાળ ૧૩ અંકુર ફૂટેલું કઠોળ ૧૩ શાક અને કળ ૧૩ હિંદની સલ્યતાને ડાઘ ૧૩ હેહાતીઓ અને લીલોતરી ૧૩ જમીન વપરાશના કાયદા અને કળજાડ ૧૩
દૂધ છોડયાથી શરીરને થયેલું નુકસાન ૮	પત્તીભાજુ ૧૩ સ્ટાર્ચવાળાં શાક ૧૩ અનાજની કોટિનાં શાક ૧૩ કાચાં વાપરવાં જોઈતાં શાક ૧૩ મોસમનાં કળો ૧૩-૪ કળ કચારે ખાવાં? ૧૪ કેળાં, દૂધ, ભાજુ સંપૂર્ણ ખોરાક ૧૪
દૂધ ન લેવાનું પ્રત ૮	ખોરાકમાં ચીકણા પદાર્થ ૧૪
બકરીનું દૂધ ૯	ધી, તેલ ૧૪
પ્રતનો આત્મા હણાયો ૯	માણસે કેટલું ધી લેવું જોઈએ? ૧૪
દૂધની અનિવાર્ય ૪૩૨ ૯	
દૂધમાં ઉત્તરતા ગુણો ૯	
રોગી પશુ ૯	
નીરોગી હેંખાતાં રોગી પશુ ૯	
ઉકાળેલું દૂધ લેવું ૧૦	
કટલ થયેલાં પશુઓ ૧૦	
મનુષ્યની મોટી ચિંતા ૧૦	
ચુક્તાહાર ૧૦	
મનુષ્ય શરીરને શાની ૪૩૨? ૧૦	
સ્નાયુ બાંધનાર દ્રોયો ૧૦	
માંસ અને દૂધ ૧૦	
સેપરેટ દૂધ ૧૦	
દૂધનો ગુણ ૧૧	
ધઉં, બાજરો, ચાવલ વગેરે અનાજ ૧૧	
એક જતના ગુણવાળાં અનાજો સાથે લેવાં વર્જર્ય છે ૧૧	
હોજરી ઉપર પડતો બોળે ૧૧	
અનાજેનો રાજ ધઉં ૧૧	

તલ, કોપરાં, મગધળીનાં તેલ ૧૪	કેટલું અને કેટલી વખત ખાવું? ૧૫
બજરનાં ધી-તેલ ૧૪	ઓપથડપ ખોરાક ૧૫
ગોળખાડ ૧૪	રસમાં સ્વાદ ૧૫
ગળપણ કેટલું લેવું જોઈએ? ૧૪	હોજરી શું માગે છે? ૧૫
મીઠાઈ ૧૪	માતા, પિતા અને સંતાન ૧૫
મીઠાઈ ખાવી એ ચોરી ૧૫	ગલધિયાન પછી આણારની
તળેલી વસ્તુઓ ૧૫	અસર ૧૫-૧
પૂરી, લાદુ વગેરે ૧૫	બુદ્ધિજીવીનો ખોરાક ૧૬
અંગેણે અને આપણો ખોરાક ૧૫	નિમટ અને લીધુ ૧૬
ભૂખ અને સ્વાદ ૧૫	કેટલી વાર ખાવું? ૧૬

## ૫. મસાલા

૧૭-૮

નિમટ ૧૭	ઓપથડપે મસાલા ૧૭
રાંધવાથી કારોનો નાશ ૧૭	બગાંલ જીબ ૧૭
મસાલાની અનાવશ્યકતા ૧૭	મરચાંથી મૃત્યુ ૧૮
મરચાં, મરી, રાઈ, મેથી વગેરે ૧૭	મસાલા અને હળસી ૧૮

## ૬. ચા, કોકી, કોકો

૧૮-૯

ચા, કોકી, કોકો ૧૮	હોજરી ઉપર ટેનિનની અસર ૧૯
ચા અને ચીન ૧૮	ચા અને રોગો ૧૯
ચા અને પાણીની પરીક્ષા ૧૮	ચાને બદલે મધ અને લીધુ ૧૯
ચા બનાવવાની રીત ૧૮	ચા અને કોકી અથવા કોકો ૧૯
દોષિત ચા ૧૮	ચા, કોકી, કોકોનો ત્યાગ ૧૯
ચામાં ટેનિન ૧૮	ચાને બદલે ભાજુઓનો ઉકાળો ૧૯

## ૭. માદક પદાર્�ો

૨૦-૨૩

માદક પદાર્થો ૨૦	તાડી-ખોરાક ૨૦
તાડી, એરક, દાડ ૨૦	મનુષ્યના ખોરાકમાં તાડીનું સ્થાન ૨૦
શરાબી મનુષ્ય ૨૦	ખજૂરીનો શુષ્ક રસ-નીરો ૨૧
મહિરા અને મર્યાદા ૨૦	નીરાથી હસ્ત સાદ ૨૧
પ્રમાણસરનું માદક પીણું ૨૦	નીરો-ખોરાક ૨૧
તાડી અને પારસીઓ ૨૦	ચાને બદલે નીરો ૨૧

નીરાનો ગોળ ૨૧  
 નીરો અને માહકતા ૨૧  
 તાંગોળનું ગળપણ ૨૧  
 ગરીબો ભાંટ સર્સ્તો ગોળ ૨૧  
 તાંગોળમાંથી સાકર ૨૧  
 નીરાની સાકરના ગુણ ૨૧  
 ગોળ અને સાકર ૨૧  
 સ્વાભાવિક સ્થિતિમાં ખોરાકના ગુણ ૨૨  
 શરાબની અદી ૨૨

ગિરમીટિયા અને શરાબ ૨૨  
 આહિકાનો શરાબનો કાયદો ૨૨  
 શરાબ અને હાલસીઓ ૨૨  
 શરાબ અને અંગ્રેજ ૨૨  
 એક શરાબી અંગ્રેજ ૨૨-૩  
 શરાબ અને રાજાઓ ૨૩  
 શરાબ અને ધનિક યુવકો ૨૩  
 શરાબથી શરીરની, મનની, અને  
 જુદ્ધિની હાનિ ૨૩

#### C. અદીણ ૨૩-૨૪

અદીણ ૨૩  
 શરાબ અને અદીણ ૨૩  
 અદીણથી જડતા ૨૩  
 અદીણની અસરનાં કળ ૨૩  
 ઓરિસા, આસામમાં અદીણ ૨૩  
 અદીણ અને ચીન ૨૪  
 અદીણની લત અને પાપ ૨૪

અદીણની લગાઈ ૨૪  
 હિંદનું અદીણ અને ચીન ૨૪  
 અંગ્રેજોને અને અદીણનો વ્યાર ૨૪  
 મંહસૂલ અને અદીણ ૨૪  
 દુંહંડમાં અદીણનો વિરાધ ૨૪  
 ઓષધિદંપે અદીણ ૨૪  
 અદીણ વ્યસન અને દવા ૨૪  
 અદીણ - ઝર ૨૪

#### E. તમાકુ ૨૫-૨૭

તમાકુ ૨૫  
 જગત અને તમાકુ ૨૫  
 ગાંઠસ્થાય અને તમાકુ ૨૫  
 તમાકુ અને પાંચશીઓ ૨૫  
 તમાકુ અને રેલની સકર ૨૫  
 તમાકુના ધુમાડાની બીજ  
 ઉપર અસર ૨૫  
 તમાકુ અને થ્રુકલું ૨૫  
 તમાકુની સ્રુકમ લાગાયી  
 ઉપર અસર ૨૫

તમાકુ અને બદામો ૨૫  
 તમાકુનો કક ૨૫-૬  
 તમાકુ અને ખૂન ૨૬  
 તમાકુ કુંકવી, સુંઘવી, ચાવવી ૨૬  
 જરહો ગંદી વસ્તુ ૨૬  
 તમાકુ વિશે કાંહવત ૨૬  
 તમાકુ અને ધરની હીવાલો ૨૭  
 છીકાણી અને કપડાં ૨૭  
 તમાકુ ગંધુ વ્યસન ૨૭

## ૧૦. બ્રહ્મચર્ય

૨૭-૩૪

- બ્રહ્મચર્ય ૨૭  
 સંયમ અને બ્રહ્મ ૨૭  
 બ્રહ્મચર્યની સામાન્ય વ્યાખ્યા ૨૭  
 બ્રહ્મચર્ય અને ઈદ્વિયનિગ્રહ ૨૭  
 બ્રહ્મચારી અને કોધ ૨૭  
 કહેવાતા બ્રહ્મચારી ૨૭  
 બ્રહ્મચર્ય અને સામાન્ય નિયમ ૨૭  
 વીર્યસંગ્રહ અને લીસંગ ૨૭-૮  
 બ્રહ્મચર્ય અને લીસંગમાં રસ ૨૮  
 જનનેદ્વિય ઉપર જુત ૨૮  
 બ્રહ્મચારીનો પ્રલાવ ૨૮  
 બ્રહ્મચર્ય અને લીસ્પર્શ ૨૮  
 બ્રહ્મચારી અને લીપુરુષનો લેદ ૨૮  
 બ્રહ્મચારી અને સ્વેચ્છાચાર ૨૮  
 બ્રહ્મચર્ય અને ખૂબસૂરતીના ઘ્યાલ ૨૮  
 બ્રહ્મચર્ય અને આચાર ૨૮  
 બ્રહ્મચારીની જનનેદ્વિય ૨૮  
 બ્રહ્મચારી અને નપુંસકતા ૨૮  
 નપુંસકના રસ ૨૮  
 નપુંસકતા ઊર્ધ્વગામી ૨૮-૯  
 જવલ્લે જ મળતા બ્રહ્મચારી ૨૯  
 બ્રહ્મચર્ય અને ગાંધીજી ૨૯  
 બ્રહ્મચર્ય અને ગાંધીજીના પ્રયોગો ૨૯  
 બ્રહ્મચર્ય અને વીર્યરક્ષા ૨૯  
 વીર્યની શક્તિ ૨૯  
 વીર્ય અને ભોગ ૨૯  
 વીર્યનો ઉપયોગ ૨૯  
 વિવાહ અને લી-પુરુષ ૨૯  
 વિવાહિતો બ્રહ્મચારી ૩૦  
 લી-સંગ કર્તવ્ય ૩૦

- સામાન્ય અનુભવ અને પ્રગતિ ૩૦  
 ભૌતિકને તે જ આત્મિકને ૩૦  
 લી-પુરુષ અને પશુઓ ૩૦  
 સાહસિકોની શોધ સંયમધર્મ ૩૦  
 સંયમધર્મના પ્રયોગો ૩૦  
 વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ ૩૦  
 વીર્ય અને ખોરાક ૩૦-૧  
 અલ્પાહારી મજબૂત ૩૧  
 બ્રહ્મચારી અને ઘડપણ ૩૧  
 બ્રહ્મચારીની બુદ્ધિ ૩૧  
 બ્રહ્મચર્યમાં ન્યૂનતા ૩૧  
 વીર્યસંગ્રહમાં આરોગ્યની ચાવી ૩૧  
 વીર્યસંગ્રહના નિયમો ૩૧  
 વિકાર અને વિચાર ૩૧  
 વીર્યસંગ્રહ અને જપ ૩૧  
 વિચાર, વાચા, વાચન ૩૨  
 તોળીને બોલવું ૩૨  
 વિષય પોષણું સાહિત્ય ૩૨  
 વિકાર અને નિદ્રા ૩૨  
 વીર્યસંગ્રહમાં ગણિતને સ્થાન ૩૨  
 વિકાર અને ધંધા ૩૨  
 શરીરશ્રમ અને નિદ્રા ૩૨  
 વેગે ફરવું ઉત્તમ કસરત ૩૨  
 ફરવાના નિયમો ૩૨  
 વિકાર અને આળસ ૩૨  
 ઈન્દ્રિયોના યોગ્ય ઉપયોગની અસર ૩૨  
 આહાર અને આકાર ૩૩  
 સ્વાદ અને ઈદ્વિયજિતપણું ૩૩  
 શરીર અને આહાર ૩૩  
 ઈશ્વરની ઓળખ ૩૩

પુરુષની સ્ત્રી પ્રત્યેની દિલ ૩૩

સીની પુરુષ પ્રત્યે દિલ ૩૩

અહૃત્યર્થમાં રસ ૩૩

અહૃત્યર્થ માટે ધગશ ૩૩

કૃત્રિમ ઉપાયો ૩૩

પ્રજ્ઞેત્પત્તિના ઓળની અમણા ૩૩

સંયમધર્મનો લોપ ૩૪

'નીતિનાશને માગે' વાંચવાની ભલામણ

૩૪

કૃત્રિમ ઉપાયોથી દૂર રહેવું ૩૪

સાચ્ચો હંપતીપ્રેમ ૩૪

ત્યાગનો આરંભ ૩૪

## ભાગ બીજો

### ૧. પૃથ્વી એટલે માટી ૩૫-૩૮

નૈસર્જિક ઉપચાર ૩૫

ડૉ. પ્રાણજીવન મહેતા ૩૫

બંધકોષ ૩૫

કૂટ સોલ્ટ ૩૫

લોહ (દાયલાઇઝ) ૩૫

નક્સવાભિકા ૩૫

દ્વાચો ઉપર અવિશ્વાસ ૩૫

ફરવાની કસરત ૩૬

જુસ્ટનું રિટન દુ નેચર ૩૬

માટીના ઉપચાર ૩૬

માટીના ઉપચાર અને બંધકોષ ૩૬

માટીની પોલ્ટીસ ૩૬

અરંદિયાનો જુલાબ ૩૬

માટીની લોપરીનું માપ ૩૬

સર્પદંશ અને માટી ૩૬

માટી અને માથું દુખવું ૩૬

માટી અને ફોડા ૩૭

માટી અને પરમેણેટનું પાણી ૩૭

માટી અને ભમરીનો ડાય ૩૭

માટી અને વીછીનો ડાય ૩૭

સેવાગ્રામમાં વીછી ૩૭

માટી અને તાવ ૩૭

માટી અને ટાઈફોઈડ ૩૭

સેવાગ્રામમાં ટાઈફોઈડ ૩૭

માટી અને એન્ટીક્લોબિસ્ટીન ૩૭

માટી અને સરસિયું તેલ ૩૭

માટીને શુદ્ધ ફરવાની રીત ૩૭

માટીની જાત ૩૮

માટી અને સુગંધ ૩૮

માટી અને શહેરો ૩૮

માટી અને ચીકાશ ૩૮

માટી અને ખાતર ૩૮

માટીને શેકવી ૩૮

માટીનો ફરી ફરીને ઉપયોગ ૩૮

માટી જમનાની ૩૮

માટી અને દસ્ત ૩૮

### ૨. પાણી ૩૯-૪૬

કચુને અને આંધ ૩૯

કચુને અને કટીસ્નાન ૩૯

કચુને અને ધર્ષણસ્નાન ૩૯

ટબનું માપ ૩૯

પાણી ઠારવા બરકનો ઉપયોગ ૩૯

પાણી અને પંખો ૩૯

ટબ અને ભીત ૩૬  
પાણીમાં બેસવાની રીત ૩૬  
ધર્મશ કેવી રીતે કરવું? ૩૬  
સ્નાન અને તાવ ૩૬-૪૦  
સ્નાન કચારે લેવાય? ૪૦  
સ્નાન અને બંધકોષ ૪૦  
સ્નાન અને અજીર્ણ ૪૦  
સ્નાન પછી ચાલવું ૪૦  
સ્નાન અને સન્નિપાત ૪૦  
કચુને અને બીમારીનાં કારણો ૪૦  
કટીસ્નાન અને તાવ ૪૦  
નૈસર્જિક ઉપચારો અને દાક્તરો ૪૦  
મનુષ્ય અને નમ્રતા ૪૧  
નૈસર્જિક ઉપચારો અને અખાધડો ૪૧  
પાણી અને માથું દુખવું ૪૧  
ધર્મશસ્નાન અને જનનેદ્રિય ૪૧  
જનનેદ્રિય અને અદ્ભુતતા ૪૧  
ધર્મશસ્નાનની રીત ૪૧  
ધર્મશસ્નાન, ટબ અને લોટો ૪૨  
જનનેદ્રિય અને સંશોધન ૪૨  
જનનેદ્રિયની સંશોધન અને બ્રહ્મચર્ય ૪૨  
જનનેદ્રિય અને વીર્યસ્થાવ ૪૨

ચાદરસ્નાન અને નિદ્રા ૪૨  
ચાદરસ્નાન કેવી રીતે લેવાય? ૪૨-૩  
ચાદરસ્નાન અને હાર્દિની નિદ્રા ૪૩  
ચાદરસ્નાન અને ન્યુમોનિયા ૪૩  
ચાદરસ્નાન અને ટાઇબોઈડ ૪૩  
ચાદરસ્નાન અને અળાઈ, શીળસ ૪૪  
ચાદરસ્નાન અને શીતળા, અછબડા ૪૪  
ચાદરસ્નાનવાળી ચાહરની સંશોધન ૪૪  
બરદ્ધ અને લોહિનું કરવું ૪૪  
ગરમ પાણીના ઉપયોગ ૪૪  
ગરમ પાણી અને સોજો ૪૪  
ગરમ પાણી અને કાનનું દર્દ ૪૪  
આયોડિન ૪૪  
ગરમ પાણી અને વીછીનો ડંબ ૪૫  
ગરમ પાણી અને ટાંડ ૪૫  
ગરમ પાણી વરાળદ્વપે ૪૫  
વરાળ અને સંધિવા ૪૫  
વરાળ લેવાની રીત ૪૫  
વરાળ અને અંગાર ૪૫-૬  
ગરમ પાણી અને વસાણાં ૪૬  
વરાળ અને કળતર ૪૬  
વરાળ અને સળેખમ ૪૬

## ૩. આકાશ

૪૭-૫૦

આકાશ અને આપણે ૪૭  
આકાશ અને આરોગ્ય ૪૭  
આકાશ અને ઈશ્વર ૪૮  
આકાશ અને આદર્શ ૪૮  
શરીર અને લોગ ૪૮  
આકાશ અને સ્વચ્છતા ૪૯

આકાશ અને સાદાઈ ૪૯  
આકાશ અને આરોગ્ય ૪૯  
આકાશ અને સૂવાનું સ્થાન ૫૦  
આકાશ અને નિદ્રા ૫૦  
આકાશ અને આહાર ૫૦  
આકાશ અને ઉપવાસ ૫૦

## ૪. તેજ

૫૦-૫૧

તેજ અને મનુષ્ય ૫૦  
સૂર્ય અને સ્નાન ૫૧  
સૂર્ય અને લૂંઘ ૫૧

સૂર્ય અને રોગો ૫૧  
સૂર્ય અને માટી અથવા કેળનાં

પાંડડા ૫૧

## ૫. વાયુ-હવા

૫૨

પહેલા લાગનું બીજું પ્રકરણ જુદ્દો.

## પ્રાસ્તાવિક

આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન નામના ભથ્થાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષેણ આંકિકામાં સન ૧૯૦૬ની ઇન્ડિયન ઓપીનિયન પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિન્દુસ્તાનમાં તો કોઈ જ જગ્યાએ મળતું. હું દેશમાં પાછો કર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. ડેઝ સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિફની ઘણી ભાષામાં થયા. અંગેજુ તરજુમો પણ કોઈ ભાઈએ પ્રગટ કર્યો. એ પશ્ચિમમાં પહોંચ્યો. તેના યુરોપની ભાષાઓમાં તરજુમા થયા. પરિણામ એ આંધ્રાને, મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં એટલું લોકપ્રિય નથી થવા પાંચંચ્ચું જેટલું મજફૂર પુસ્તક. આનું કારણ હું આજ લગી સમજુ નથી શક્યો. મેં એ પ્રકરણો સહેજે લખેલાં. મારી પાસે એની ખાસ કહેર ન હતી. એ પુસ્તકની નવી આવૃત્તિની માગણી ઘણા મિત્રો તરફથી થઈ છે. જે ઇપે મેં મૂળ લખ્યું છે તેમાંના વિચારોમાં કંઈ કેરકાર થયો છે કે નહીં, એ જાણવાની ઇચ્છા અનેક મિત્રોએ દર્શાવી છે. આજ લગી મને એ ઇચ્છાની તૃપ્તિ કરવાનો સમય જ નહોતો મળ્યો. એ અવસર આજે આંધ્રો છે. તેનો લાભ લઈને એ પુસ્તક છેક નવું જ લખી રહ્યો છું. મૂળ પુસ્તક મારી પાસે નથી. આએલાં બધાં વર્ષોના અનુભવની અસર મારા વિચારો ઉપર પડ્યા વિના નહીં રહી હોય. પણ જેણે મૂળ વાંચ્યું હશે તે જોશે કે, મારા આજના વિચારોમાં ને ૧૯૦૬ની સાલના વિચારોમાં મૌલિક કેરકાર નથી થયો.

આ પુસ્તકને નવું નામ આંધ્રાનું છે : આરોગ્યની ચાબી ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈધોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું.

આગામ્યાન મહેલ,

યરવડા,

૨૭-૮-'૪૨

મોં ૫૦ ગાંધી

## આરોગ્યની ચાવી

### ભાગ પહેલો

#### ૧. શરીર

શરીરનો પરિચય કરીએ તે પહેલાં આરોગ્યનો અર્થ જાણી લેવો।  
ઠીક ગાણાશો. આરોગ્ય એટલે શરીર-સુખાકારી.

૨૮-૮-'૪૨ જેનું શરીર વ્યાધિરહિત છે, જેનું શરીર સામાન્ય  
કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે

રોજ દશ-બાર માઈલ ચાલી શકે છે, સામાન્ય મજૂરી થાક વિના  
કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઈન્ડ્રિયો અને  
મન આખાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મહ્લે  
શરીરનો કે અતિશય હોડનાર ફૂદનારનો સમાવેશ નથી થતો. એવાં  
અસાધારણ બળ બતાવનારાં રોગાગ્રસ્ત હોઈ શકે છે. એવા શરીરનો  
વિકાસ એકાંગી કહેવાય.

ઉપરોક્ત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશો  
પરિચય આવશ્યક છે.

પૂર્વે કેવી તાલીમ લેવાતી હશે એ હૈવ જાણે; સંશોધકો કંઈક  
જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાને થોડુંધાળું છે જ.  
એ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઈ જ સંગ્રહ નથી હોતો.  
શરીર જેનો આપણને સહાય ઉપયોગ છે, તેનું જ્ઞાન આપણને એ  
તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમ જ આપણા ગામનું, આપણાં  
ખેતરનું જ્ઞાન. પણ હુનિયાની ભૂગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ  
પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય  
નથી. પણ બધી વસ્તુ, પોતાને સ્થાને શોભે. શરીરનું, ધરનું,

ગામનું, ગામના સીમાડાનું, ગામનાં એતરોની વનસ્પતિનું, તેના ઈતિહાસનું જ્ઞાન સારું હોવું જોઈએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે છે.

શરીર પંચ-મહાભૂતનું બનેલું છે, તેથી જ એક કવિતામાં ગાયું છે:

૨૧-૮-'૪૨

પૃથ્વી, પાણી, આકાશ તેજ ને વાયુ,

એ પંચ તત્ત્વનાં એલ જગત કહેવાયું.

શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રિયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈન્દ્રિયોમાં પાંચ કર્મનિદ્રિય છે ને પાંચ જ્ઞાનેનિદ્રિય. પાંચ કર્મનિદ્રિય તે હાથ, પગ, મોં, જનનેનિદ્રિય અને ગુદા. જ્ઞાનેનિદ્રિય તે સ્પર્શી કરનારી ત્વચા, જોનારી આંખ, સાંભળનારા કાન, વાસ ઓળાખનારું નાક, અને સ્વાદ કે રસ ઓળાખનારી જીબ. મન વડે આપણે વિચાર કરીએ છીએ. કોઈ મનને અગિયારમી ઈન્દ્રિય તરીકે ઓળાખાવે છે. આ ઈન્દ્રિયોનો વ્યવહાર સંપૂર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઈકને જ સાંપર્તું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વિભાગો આપણને આશ્રયચક્તિ કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આખાદ નમૂનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી. જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી 'યથ પિંડ ત્રહાર્દ' મહાવાક્ય નીકળ્યું છે. એટલે જે આપણે શરીરને પૂર્ણ રીતે ઓળાખી શકીએ તો જગતને ઓળાખીએ છીએ એમ કહેવાય. પણ એવી ઓળાખ દાક્તરો, વૈધો, હકીમો સુધ્યાં નથી પામી શક્યા, તો આપણે સામાન્ય પ્રાણી કયાંથી જ પામીએ? હજુ લગી કોઈ હથિયાર નથી શોધાયું કે જે મનને ઓળાખે. તજ્જ્વરો શરીરની અંદર ને બહાર જે કિયાઓ ચંદે છે તેનું આકર્ષક વર્ણન આપી શકે છે, પણ તે કિયાઓ કેમ

ચાલે છે એ બતાવી નથી શક્યા. મોત શા સારુ આવે છે એ કોણે જાણ્યું? ક્યારે આવશે એ કોણ કહી શક્યું છે? અર્થાતુ મનુષ્યે ધર્મનું વાંચ્યું, વિચાર્યું, અનુભંગું, પણ પરિણામે તેને પોતાના અદ્યપજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.

શરીરની અંદર જે અહલુત કિયાઓ ચાલે છે તેની ઉપર ઈન્દ્રિયોની સુખાકારીનો આધાર છે. શરીરમાં રહેલાં બધાં અંગોનિયમનમાં રહે તો વ્યવહાર સુંદર ચાલે. એક પણ અંગ અટકે તો ગાડી અટકી પડે. તેમાંથે હોજરી પોતાનું કામ બરોબર ન કરે તો તો શરીર ઢીલું થઈ જય છે. તેથી અપચા કે અંધકોષને જે આવગળે છે તે શરીરના ધર્મ નથી જાણતા. અનેક રોગો એમાંથી ઉત્પન્ન થાય છે.

હવે શરીરનો ઉપયોગ શો છે તે વિચારીએ.

હરેક વસ્તુનો સદૃષ્યોગ કે દુર્દૃષ્યોગ હોઈ શકે છે. આ નિયમ શરીરને વિશે પણ લાગુ પડે છે. શરીર સ્વાર્થીને ૩૦-૮-'૪૨ સ્વચ્છદને સારુને જીજાનું બગાડવા સારુ વપરાય તો તેનો દુર્દૃષ્યોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધ્યાય, તો તેનો સદૃષ્યોગ થયો. મનુષ્યશરીરને જો આપણે, આત્મા જે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહેવાનું મંહિર બને છે.

શરીરને મળમૂત્રની આણ તરીકે વર્ણવવામાં આંધું છે. એક રીતે વિચારતાં તેમાં જરાય અતિશયોક્તિ નથી. જો શરીરની એ જ ઓળખ હોય તો તેનું જતન કરવામાં કર્શો અર્થ નથી. પણ જુદી રીતે ઓળખમીએ, તેને મળમૂત્રની આણ કહેવાને બદલે તેમાં કુહરતે મળમૂત્રાદિને કાઢનારા નળો પણ મૂક્યા છે એમ સમજુએ, તો તેને સારુ રામીને તેને સાચવવાનો ધર્મ પેદા થાય છે. હીરાનીને સોનાની

આણમાં જુઓ તો તે ખરે જ માટીની આણ છે, પણ તેમાં સોનું કે હીરા છે એ જ્ઞાન માણસની પાસે કરોડો ડિપિયા ખરચાવે છે ને તેની પાછળ અનેક શાલકોની બુદ્ધિ કામ કરે છે. તો આત્માના મંદિરદ્વય શરીરને સારુ શું ન કરીએ? આ જગતમાં જન્મ પામીએ છીએ તે જગતનું લોણ ચૂકવવા સારુ, એટલે તેની સેવા કરવા સારુ. એ દાખિએ જોતાં મનુષ્યે પોતાના શરીરના સંરક્ષક બનવાનું છે. એનું તોણે એવી રીતે જતન કરવું જોઈએ કે જેથી તે સેવાધર્મના પાલનમાં સંપૂર્ણ કામ આપી શકે.

## ૨. હવા

શરીરને સૌથી વધારે અગત્યની વસ્તુ હવા છે. તેથી જ કુદરતે હવાને વ્યાપક બનાવી છે. એ આપણાને વગર પ્રયત્ને મળી રહે છે.

હવા આપણે નસકોરાં વડે ફેઝસાંમાં ભરીએ છીએ. ફેઝસાં ધમણાનું કામ કરે છે. તે હવા લે છે ને કાઢે છે. બહાર રહેલી ૩૧-૮-'૪૨ હવામાં પ્રાણવાયુ હોય છે. તે ન મળે તો મનુષ્ય જીવી ન શકે. જે વાયુ બહાર કાઢીએ છીએ એ એરી હોય છે. તે એ તુરત આસપાસ ફેલાઈ ન જય તો આપણે મરી જઈએ. તેટલા સારુ ધર એવાં હોવાં જોઈએ કે તેમાં હવાની આવજા છુટથી થયા કરે.

પણ આપણાને હવાને ફેઝસાંમાં ભરતાં ને કાઢતાં બરોબર આવડતું નથી. તેથી જોઈએ તેવી રક્તની શુદ્ધિ થતી નથી. કેમ કે હવાનું કામ રક્તની શુદ્ધિ કરવાનું હોય છે. કેટલાક તો મોઢેથી હવા લે છે. આ ખરાખટેવ છે. નાકમાં કુદરતે એક જતની ચાળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જવા નથી પામતી, તેમ જ તે ગરમ થાય છે. મોંથી લેતાં હવા સાંજ થઈને અંદર નથી જતી ને ગરમ પણ નથી થતી. તેથી હરેક માણસે

પ્રાણાયામ કોઈ લેવાની જરૂર છે, તો હિયા સહેલી તેણેલી આવર્થયક છે. પ્રાણાયામના જુદા જુદા પ્રકારો હોય છે, તો અધ્યાત્મા પડવાની જરૂર હું નથી માનતો. તેમાં કાયદો નથી ઓમ કંદેવાની મતલગ નથી. પણ જે માણસનું જીવન નિયમગંભુર થાંથે હેઠળી જાણી હિયા સહજરહ્યું થાંથે હે, અને તેમાં જે વાબ હે તે અનેક પ્રક્રિયાઓં અતાવવામાં આવે હે તેમાંથી નથી મળતો.

દાલતાં, ચાલતાં, સૂતાં માણસે મોટું ગંધ રાખતું ઓટલે સહેજે નાક પોતાનું કામ કરશે જ. જેમ સવારેના આપણે મોં સાંક કરીએ છીએ, તેમ જ નાક પણ સાંક કરવું જોઈએ. નાકમાં મેલ હોય તો તે કાઢી નાખવો. તેને સારુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સાંક પાણી છે. જેનાથી હું સાહન ન થાય તે નવરંધું કરીને લે. હાથ વતી કે એક કટોરા વતી પાણી નાકમાં ચઢાવી શકાય છે. એક નસકોરા વાંટ ચઢાવી બીજા વાંટ કાઢી શકાય. નાકથી પાણી પી પણ શકાય છે.

હવા ચોખ્યારી જ લેવાની જરૂર છે. તથી રાતના આકાશ નીચે અથવા ઓસરીમાં સૂવાની ટેવ પાડવી અંસ સારું છે. હવાથી શરહી લાગી જવાનો ડર ન રાખવો. ટાંડ વાય તો બૃદ્ધાબર ઓફલું. નાક વાંટ બહારની તાજુ હવા રાતના પણ મળવી જ જોઈએ. મોટું દાંકવાથી માણસો ગુંગળાઈને મરી જાય છે. તથી ઓફલાનું ગળાની ઉપર ન જાય ઓમ સૂવું. માથે હંડી લાગે તે સાહન ન થાય તો માથું એક ઇમાલ વડે દાંકવું.

સૂતી વખતે હિવસે પહેંચેલાં કપડાં ન વાપરતાં બીજાં ને ઓછામાં ઓછાં વાપરવાં. લંગોટીમાત્રથી કામ સરે છે. રાતના શરીરને આપણે દાંડીએ છીએ એટલે શરીર જેટલું મોકળું રખાય તેટલો

કશથો જ છ. દિવસનાં કપડાં પણ જેટલાં મોકળાં હોય તેમ સારુ.

આપણી આસપાસની હવા ચોખારી જ હોય છે અને મ નથી હોતું. અધી હવા એકસરારી હોય છે અને પણ નથી હોતું. પ્રેદેશી પ્રેદેશી હવા અદલાય છે. પ્રેદેશની પસંદગી આપણા લાયમાં નથી હોતી. પણ જે પ્રેદેશમાં રહેવાનું થાય ત્યાં તાં પસંદગીને થોડો વળો અવકાશ હોય છે, હોવો જોઈએ. સામાન્ય નિયમ આમ મૂડી શકાય: જ્યાં બાંધ ભીડ ન હોય, આસપાસ ગંઢી ન હોય, ત્યાં હવાઅજવાળાં અરોગ્ય ભળી શક એવું ઘર રોધવું.

### ૩. પાણી

શરીરને ટકાવવામાં હવાથી બીજે દરજને પાણીનો છે. હવા વિના માણસ થોડી કાળ જ જીવી શંક. પાણી ૧-૦-૧૫૨ વિના કેટલાક દિવસ કાઢી શકાય. પાણીની બાંધ જરૂરિયાત હોવાથી કુદરતે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પૂર્ણ પાડ્યું છે. પાણી વિનાની ભરભૂમિમાં માણસ વસી શકતો જ નથી, જેથી સાહરાના રાણ જેવા પ્રેદેશમાં કેદી વસ્તી જોવામાં નથી આવતી.

દરેક માણસે આરોગ્ય જળવવાને સારુ પાંચ રતલ પાણી પેટમાં જય તેણું પ્રવાહી લેવું જોઈએ. પાણી સ્વચ્છ હોવું જોઈએ. ધારે ઠકારે પાણી સ્વચ્છ હોતું નથી. ફૂવાનું પાણી પીવામાં જોગમ હોય છે. છીછરા ફૂવા કે વાવ જેમાં માણસ ઉતારી શકે છે તેનું પાણી પીવા લાયક નથી હોતું. હુઃઅની વાત એ છે કે, પાણી પીવા લાયક છે કે નહીં એ આંગ હમેશાં અતાવી નહીં શકે, સ્વાદ પણ નહીં અતાવી શકે. નજરને અને સ્વાદને શુદ્ધ લાગતું પાણી પીવામાં જેરડપ હોઈ શકે. તેથી અજાણ્યા ફૂવાનું ક અજાણ્યા ઘરનું પાણી ન પીવાની પ્રથા અનુસરવા જેવી છે. બંગાળમાં તળાવો

હોય છે તેનાં પાણી ઘાણી વેળા પીવા લાયક નથી હોતાં. માણી નહીંઓનાં પાણી પણ જ્યાં સ્ટીમરો ને વળાણાની આવજી હોય છે ત્યાં પીવા લાયક નથી હોતાં. આમ છતાં કરોડો માણસો આવાં પાણી પીને ગુજરો કરે છે એ સાવ સાચી વાત છે, છતાં અનુસરવા લાયક ન જ ગણાય. કુદરતે જીવનશક્તિ બહુળા પ્રમાણમાં ન આપી હોત તો મનુષ્ય જે છૂટો લે છે તેથી તેનો કચારનો લોપ થઈ ગયો હોત. આપણે તો આહી પાણીનાં આરોગ્ય સાથેનો સંઅંગ તપાસીએ છીએ. જ્યાં પાણીના શુદ્ધપણા વિશે શાકા હીય ત્યાંનું પાણી ઉકાળીને પીવું જોઈએ. આનો અર્થ એ થયો કે, માણસે પોતાને પીવાનું પાણી સાથે લઈને ફરવું જોઈએ. અસંખ્ય માણસો ધર્મનિનામાં પાણી નથી પીતા. અજ્ઞાની માણસો જે ધર્મના નામે કરે છે તે આરોગ્યના નિયમો જાળનાર આરોગ્યને ખાતર કાં ન કરે? પાણીને ગાળવાની પ્રથા વખાળવા લાયક છે. એથી પાણીમાંનો કચરો નીકળી જય છે. પાણીમાંનાં સૂક્ષ્મ જંતુઓ તો નથી નીકળતાં. એનો નાશ કરવા સારુ પાણી ઉકાળ્યે જ છૂટકો. ગળાણું હંમેશાં સાક હોવું જોઈએ. એમાં કાણાં ન હોવાં જોઈએ.

#### ૪. ખોરાક

હવાપાણી વિના મનુષ્ય જીવી જ નથી શકતો એ ખરું, પણ  
મનુષ્યનો નિર્વાહ તો ખોરાકથી જ થઈ શકે.  
અન્ન એનો પ્રાણ છે.

ખોરાક ત્રણ જાતનો કહેવાય: માંસાહાર, શાકાહાર, ને મિશ્રાહાર. અસંખ્ય માણસો મિશ્રાહારી છે. માંસમા માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દૂધને કોઈ પણ રીતે આપણે શાકાહારમાં નથી ગણી શકતા. તેમ લૌકિક ભાષામાં એ કહી

માંસાહારમાં નથી ગણાતું. સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ધારે ભાગે દૂધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ અઓરાક-અનિમલ કૂડ-માં કરવામાં આવી છે. ઈડાં સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈડાં એવી રીતે પેઢા કરવામાં આવે છે કે મરધીને મરધો બતાવવામાં નથી આવતો, છતાં તે ઈડાં મૂકે છે. આ ઈડાં કદ્દી પાકતાં નથી. તેમાં મરધું નહીં થઈ શકે. એટલે એને દૂધ પીવામાં હરકત નથી તેને આ ભીજ પ્રકારનાં ઈડાં લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

દાક્તરી મત મુખ્યત્વે મિશ્રાહાર તરફ ટળે છે. જોકે પશ્ચિમમાં દાક્તરોનો એક મોટો સમુદ્દરાય નીકળ્યો છે જેનો દઠ અભિપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચના જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહારી સિદ્ધ કરે છે. શાકમાં ઇણોનો સમાવેશ કર્યો છે. અને ઇણોમાં સૂકાં અને લીલાં બંને આવી જય. સૂકાંમાં અદામ, પિસ્તાં, આમરોટ, ચિલગોજ વગેરેનો સમાવેશ છે.

મારા પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબૂલ કરવું પડ્યું છે કે, દૂધ અને દૂધમાંથી નીપજતા પહાર્થો-માખણ, દાડી, વગેરે વિના મનુષ્યશરીરનો નિભાવ સંપૂર્ણ રીતે નથી થઈ શકતો. મારા વિચારોમાં આ મહાત્વનો ફરજાર થયો છે. મેં દૂધધી વિના છ વર્ષ ગાળ્યાં છે. તે વાગ્તે મારી શક્તિમાં કશી ન્યૂનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનનો લીધે હું ૧૯૧૭ની સાલમાં સાત મરડાનો ભોગ અન્યો. શરીર હાડપિંજર થઈ ગયું. હઠપૂર્વક દવા ન લીધી અને એટલી જ હઠપૂર્વક દૂધ કે છાશ ન લીધાં. શરીર કમેય ન આંધી શકાય. દૂધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, “પણ તે તો ગાયબેંસના દૂધ વિશે હોય.”

"બકરીનું દૂધ કેમ ન લેવાય?" ધર્મપત્નીએ ટાપસી પૂરી ને હું પીગળથો. અંચ જોતાં જેણે ગાયબેંસના દૂધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દૂધની છૂટ હોવી ન જોઈએ, કેમ કે એ દૂધમાં પહાર્થી એક જ જાતના હોય છે. કર્કદેવળ માત્રાનો જ છે. એટલે મારા પ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય. બકરીનું દૂધ તુરત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તિ આવી ને ખાટલેથી ઉઠથો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દૂધનો પક્ષપાતી થયો છું. પણ મારો દદ વિશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતિઓમાં કોઈક તો એવી છે જ કે જે દૂધ અથવા માંસની સંપૂર્ણ ગરજ સારે અને તેના હોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે અરી.

મારી દઘિએ દૂધ અને માંસમાં દોષ તો રહ્યા જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માના દૂધ સિવાય બીજા દૂધનો અધિકાર આપણને ન હોય. આ નેતિક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દઘિએ રહ્યા છે. અનેમાં તેના માલિકના દોષો ઉતરે જ છે. પાણેલાં પશુ સામાન્યપણે તંકુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુષ્કળ રોગોં થાય છે. ધણી પરીક્ષાઓ થતાં છતાં, ધણા રોગોં પરીક્ષકની નજ્ર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવિત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. ભિત્રોની મહદ સહેજે મળી રહે છે. પણ મારાથી આતરીપૂર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઉલ્લંઘ એમ જ્યેણું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સિદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દૂધનો ઉપયોગ થયો હતો.

આસપાસના એદૂતો પાસેથી પણ દૂધ સેવામાં આશ્રમ લે છે. તેઓના દોરની પરીક્ષા કોણ કરે? દૂધ નિર્હોષ છે કે નહીં એ પરીક્ષા કહિન વસ્તુ છે. એટલે દૂધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે. જે દૂધ હેતાં પશુઓને વિશે લાગુ પડે છે તે માંસને સારુ કઠલ થતાં પશુઓને વિશે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચિંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈધ, દાક્તરો, હકીમ વગેરેનો કોઈ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષિત માને છે. તેની મોટી ચિંતા ધનપ્રતિષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચિંતા બીજી ચિંતાઓને ગળી જય છે. એટલે જ્યાં લગી કોઈ પારમાર્થિક વૈધ, દાક્તર, હકીમ ખંતપૂર્વક સંપૂર્ણ ગુણવાળી વનસ્પતિ શોધી નથી શક્યા, ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દૂધાહાર કર્યે જશે.

હવે યુક્તાહાર ઉપર વિચાર કરીએ. મનુષ્યશરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, કારો આપનાર અને મળને કાઢનાર દ્રોઘો માગે છે. સ્નાયુ બાંધનાર દ્રોઘો દૂધ, માંસ, કઠોળ તથા સૂકા મેવામાંથી મળે છે. દૂધ, માંસના દ્રોઘો કઠોળાદિ કરતાં વધારે સહેલાઈથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દૂધ અને માંસમાં દૂધ ચડી જય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દૂધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, ને માંસાહાર નથી કરતા તેને તો દૂધની બહુ મોટી ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઈંડાં સહુથી વધારે સારાં ગણાય છે. પણ દૂધ કે ઈંડાં બધાને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દૂધને વિશે એક બહુ અગત્યની વસ્તુ આડી જ કહી જાઓ. જેમાંથી માખળા કાઢી લેવામાં આવે છે એ દૂધ નકામું નથી. તે અત્યંત

કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દૂધ કરતાં ચડી જાય છે. દૂધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણિજ દ્વારા આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્વારા કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્ધું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

પૂર્ણ દૂધ કે અપૂર્ણ દૂધ ઉપરાંત બીજ પદાર્થોની જરૂર રહે છે.

બીજે દરજાને ઘઉં, બાજરો, જુવાર, ચોઆ  
૬-૯-'૪૨      વગરે અનાજને આપી શકાય. હિનુસ્તાનમાં  
પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે  
ઠેકાણે કેવળ સ્વાધને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ  
એકીવખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણોય  
વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે. શરીરના પોષણને સારુ આ  
મિશ્રણ જરૂરી નથી. એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી ને  
હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકીવખતે  
લેવું ઠીક ગણાશે. આ અનાજેમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં  
અનાજેમાં ઘઉં રાજ છે. દુનિયાની ઉપર નજર નાખીએ તો ઘઉં  
વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દાખિએ ઘઉં મળે તો ચાવલ  
અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઈત્યાદિ  
ન ભાવે કે ન રહ્યે તો ચાવલ લેવા ઘટે છે.

અનાજમાત્રને બરાબર સાંક કરીને ઘરની ઘંટીમાં હળી, ચાળ્યા  
વગર વાપરવું જોઈએ. તેની ભૂસીમાં સર્વ છે  
૬-૯-'૪૨      અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો  
છે. વળી એમાં એવો પદાર્થ હોય છેકે જે પરચા  
વગર નીકળી જાય. તે સાથે મળને પણ કાઢે છે. ચાવલનો દાણો  
નાજુક હોવાથી કુદરતે તેની ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના

ઉપયોગનું હોતું નથી. તેથી ચાવલને ખાંડવામાં આવે છે. ઉપલું પડ કાઢવા પૂરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખડિલા ચાવલને તો, તેની ભૂસી છેક નીકળી જય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જે ભૂસી રાખવામાં આવે છે તો ચાવલમાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે. કારણ કે ચાવલની ભૂસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ધઉં કે ચાવલની ભૂસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જય છે. અને ભૂસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છૂટી જય છે. ધઉં ચાવલની ભૂસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો આય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કહાય વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પૂરતો સંતોષ આપે.

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોભર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થૂક(અમી)ની સાથે મળે તેમ સારું. એ થૂક (અમી) સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ચાંચા વિના ઓરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થિતિમાં ઓરાક ખાવો લાભદાયી છે.

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વિનાના ઓરાકને સહુ કોઈ અપૂર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજૂરી કરવી પડે છે, અને જેને પૂરતું કે મુદ્દલ દૂધ મળતું નથી, તેને દાળ વિના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરિક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદી, વેપારી, વકીલ, દાક્તર કે શિક્ષક, અને જેને દૂધ મળી રહે છે, અને દાળની જરૂર નથી, એવ કહેતાં

મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસૂર હળવાં. હેખીતું છે કે, માંસાહારીને દાળની મુદ્દલ જરૂર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડચા વિના રાતભર પલાળીને કણગા ફૂટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો કાયદો કરે છે.

ત્રીજું પદ શાક અને કણને આપવું ધરે. શાક અને કણ હિનુસ્તાનમાં સસ્તાં હોવાં જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ધણી જગ્યાએ તો કણ પણ નહીં. આ ખોરાકની અછત એ હિનુસ્તાનની સલ્લ્યતા ઉપર એક મોટો દાઘ છે. હેહાતીઓ ધારે તો લીલોતરી પુષ્કળ ઉગાડી શકે છે. કણજાડોને વિશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વિષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાંની ભાજુઓ (પત્તી-ભાજ) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં હોવી જોઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શકુકરિયાં, કંદ, સૂરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લૂણીની ભાજ, સરસવ, સુવાની ભાજ, ટમેટાં રાંધવાની કશી જરૂર નથી. તેને સાદ કરી ભરોભર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

કણોમાં મોસમનાં કણ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જમકળ, પપૈયાં, અંગૂર,

ખાટાં મીઠાં લીધુ, સંતરા, મોસંબી વગેરે કળોનો છીક ઉપયોગ થવો જોઈએ. કળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દૂધ અને કળ સવારે ખાવાથી પૂર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં કળ ખાય એ દીઢ્ય છે.

કેળાં સરસ કળ છે. પણ એ સ્ટાર્ચ્યમય હોવાથી રોટલીની જગ્યા લે છે. કેળાં ને દૂધ તથા ભાજુ સંપૂર્ણ ખોરાક છે.

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશો ચીકણા પદાર્થની જરૂર છે. તે ધી-તેલથી મળી રહે છે. ધી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલો પચવામાં ભારે હોય છે; શુદ્ધ ધીના જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ધી મળે તો પૂરતું મનાવું જોઈએ. દૂધમાં ધી આવે જ છે. એટલે જેને ધી ન પરવડે તે એકલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઈએ. તેથી દેશી ધાર્ણીનાં મળે તો સારાં. ધી-તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકેળવણી વડે વેપારમાં પ્રામાણિકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજુ રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બહલે જે તે મળે તેથી કદી સંતોષ નહીં માનવો. ખોરું ધી કે ખોરું તેલ ખાવા કરતાં ધી-તેલ વિના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

જેમ ચીકટની ખોરાકમાં જરૂર છે તેમ જ ગોળખાંડની. જોકે મીઠાં કળોમાંથી પુષ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાનિ નથી. મીઠાં કળો ન મળે તો ગોળખાંડની જરૂર હોય. પણ આજકાલ મીઠાઈ ઉપર જે ભાર મૂકવામાં આવે છે તે અરોગ્ય નથી. શહેરના માણસો બહુ વધારે મીઠાઈ ખાય

છે. દુધપાક, બાસૂદી, શિખંડ, પેંડા, બરકી, જલેભી વગેરે  
મીઠાઈઓ અવાય છે. તે અધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં  
આવાથી નુકસાન કરે છે. જે હેશમાં કરોડો માણસોને પૂરું અન્ન  
પણ નથી ભળતું, ત્યાં જેઓ પકવાન આય છે તે ચોરીનું આય  
છે એમ કહેવામાં મને મુદ્દ અતિશયોક્તિ નથી લાગતી.

જેમ મીઠાઈનું તેમ જ ધી-તેલનું. ધી-તેલમાં તળેલી વસ્તુઓ  
આવાની કશી આવશ્યકતા નથી. પૂરી, લાદુ વગેરે અનાવવામાં  
જે ધીનો અર્થ થાય છે એ કેવળ વગર વિચાર્યું અર્થ છે. જેને ટેવ  
નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા  
મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ધીમાં રાધેલી  
વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે, એ મેં  
ધણી વાર જોયું છે. સ્વાહો કેળવેલી વસ્તુ છે. જે સ્વાદ ભૂખ  
પેઢા કરે છે તે સ્વાદ છપન લોગમાં નથી. ભૂખ્યો માણસ સૂકો  
રોટલો અત્યંત સ્વાદથી ખાશો. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું  
ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

કેટલું અને કેટલી વખત ખાવું એ વિચારીએ. ખોરાકમાત્ર  
ઓષ્ઠદિપે લેવો જોઈએ; સ્વાદને આતર કદી  
૧-૯-'૪૨      નહીં સ્વાદમાત્ર રસમાં રહ્યો છે, અને રસ  
ભૂખમાં છે. હોજરી શું માગે છે એની ખબર બહુ  
થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

જનમદાતા માતાપિતા કંઈ ત્યાગી ને સંયમી નથી હોતાં. તેમની  
ટેવો થોડેધણે અંશો બચ્ચામાં ઉત્તરે છે. ગર્ભાધાન પછી માતા જે  
આય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાળ્યાવસ્થામાં  
માતા અનેક સ્વાહો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને  
અવરાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય

છ. તેને વડી જનાર તો અહુ વિચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાપૂર્ણ થયું છે ત્યારે શરીરસુખમાટારીના નિયમો જાળવાની તેને દૃઢ્ઢા થાય છે, ને તે નિયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

ઉપરની દાખિએ બુદ્ધિજીવી મનુષ્યનો રોજનો ખોરાક નીચે  
પ્રમાણે યોગ્ય ગાણાય:

૦-૦-૦૨

૧. બે રતલ ગાયનું દૂધ.

૨. છ ઓંસ એટલે પંદર તોલા અનાજ (ચામા,  
ઘઉં, ભાજરી ઈ. મળીને).

૩. શાકમાં પાંદડા (પત્તી-ભાજ) ત્રણ ઓંસ અને પાંચ ઓંસ  
ભીજાં શાક.

૪. એક ઓંસ કાચું શાક.

૫. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.

૬. ત્રણ તોલા ગોળા કે સાકર.

૭. તાજ કણ જે મળે તે રૂચિ અને શક્તિ પ્રમાણે. રોજ બે  
ખાટાં લીંબુ હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે કે વગર રાંધેલા પદાર્થના છે.  
નિમકનું પ્રમાણ નથી આપ્યું. રૂચિ પ્રમાણે ઉપરથી લેવું જોઈએ.  
ખાટાં લીંબુનો રસ શાકમાં લેળવાય અથવા પાણી સાથે પિવાય.

આપણે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ધણા તો ભાત  
બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વાર ખવાય છે. સવારે  
કામે ચડતાં પહેલાં, અપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત  
ખાવાની કશી જરૂર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત  
ખાય છે. આ નુકસાનકારક છે. હોજરી આરામ માગે છે.

## ૫. ભસાલા

ઓરાકનું વિવેચન કરતાં મેં ભસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને ભસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્ય માણસ કાંઈ ખાઈ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્યકતા છે. તેમાં નિમક આવી જય છે. એ ક્ષારો ઓરાકમાં હોય જ છે. પણ અશાસ્ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘરી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્યંત જરૂરી એક ક્ષાર નિમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છૂટું ખાવાને સ્થાન આપ્યું છે.

પણ જેની સામાન્યપણે માવશ્યકતા નથી એવા અનેક ભસાલા સ્વાદને ખાતર અને પાચનશક્તિ વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં (લીલાં ને સૂકાં), મરી, હળદર, ધાળાજીરુ, રાઈ, મેથી, હિંગ ઈત્યાદિ.

આને વિશે મારો અભિપ્રાય પચાસ વર્ષના જતઅનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાંના એકેયની શરીરને પૂર્ણ રીતે આરોગ્યવાન રાખવા સારુ આવશ્યકતા નથી. જેની પાચનશક્તિ છેક નબળી થઈ ગઈ હોય તેને, કેવળ ઓષ્ઠદરપે, નિશ્ચિત મુદ્દતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્વાદને સારુ તો તેનો આગ્રહપૂર્વક નિષેધ ગણાવો જોઈએ ભસાલામાત્ર, નિમક પણ, અનાજ શાકના સ્વાભાવિક રસને હણે છે. જેની જુલ અગારી નથી તેને સ્વાભાવિક રસમાં જે સ્વાદ આવે છે તે ભસાલા ને નિમક નાખ્યા પછી નથી આવતો. તેથી જ મેં નિમક લેવું હોય તો ઉપરથી લેવાનું સૂચ્યાયું છે. મરચું તો હોજરીને અને મોંને બાળે છે. જેને મરચાંની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઈ જ નહીં શકે.

ધળાંના મોઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્યું. દક્ષિણ આંધ્રિકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ ખોરાકમાં તેઓ નહીં સાંખી શકે. અંગ્રેજે આપણા મસાલા નથી લેતા.

### ૬. ચા, કોકી, કોકો

આ ત્રણેમાંથી એકેય ચીજની શરીરને જરૂર નથી. ચાનો ફેલાવો ચીનમાંથી થયો કહેવાય છે. ચીનમાં તેનો ખાસ ઉપયોગ છે. ચીનમાં પાણી ધળાંખરાં ચોપાયાં નથી હોતાં. પાણી ઉકળેલું પિવાય તો પાણીમાં રહેલો બગાડ દૂર કરી શકાય. ડાઈ ચતુર ચીનાએ ચા નામનું ઘાસ શોધી કાઢ્યું. તે ઘાસ ગાડું થાડા પ્રમાણમાં ઉકળતા પાણીમાં નખાય તો તે પાણીને સૌંનેરી રંગ આવે છે. જે એ રંગ પાણી પકડે તો તે ઉકળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એમ સાંભળ્યું છે કે, ચીનમાં લોકો આવી રીતે ચાના ઘાસ વતી પાણીની પરીક્ષા કરે છે ને એ જ પાણી પીએ છે. ચાની બીજી ખાસિયત એ છે કે, ચામાં એક જતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નિર્દોષ ગણાય. આવી ચા બનાવવાની આ રીત છે : એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર મૂકવી. ગળણી ઉપર ઉકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઉતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણવું કે પાણી ખરેખર ઉકળ્યું છે.

જે ચા સામાન્યત : પિવાય છે તેમાં કંઈ ગુણ તો જાણ્યો નથી,

પણ તેમાં એક મોટો હોષ રહેલો છે. તેમાં ટેનિન  
૧૦-૦-૧૪૨      રહેલું છે. ટેનિન એ પદાર્થ છે જે ચામડાને સખત  
કરવા સારુ વાપરવામાં આવે છે. એ જ કામ

ટેનિનવાળી ચા હોજરીને વિશે કરે છે. હોજરીને ટેનિન ચે એટલે તેની ખોરાકને પચાવવાની શક્તિ ઓછી થાય છે. એથી અપયો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, દુંગલંડમાં અસંગ્રહ ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોનો ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નિયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દૂધ એ કહાચ એના ગુણમાં ગાણી શકાય. એ જ અર્થ સારા દૂધમાં શુદ્ધ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઊકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણું બને છે.

જે ચાને વિશે કહ્યું તે કોકીને વિશે ઓછાવત્તા! પ્રમાણમાં લાગુ પડે છે. એને વિશે તો કહેવત છે કે

કક્કટન, વાયુહરણ, ધાતુલીન, અલક્ષીણ;

લોઢૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.

એમાં કેટલું તથય છે તે હું નથી જાણતો.

જે અભિપ્રાય મેં ચા કોકી વિશે આપ્યો છે તે જ કોકો વિશે છે. જેની હોજરી નિયમસર ચાલે છે તેને ચા,  
૭-૧૦-'૪૨      કોકી, કોકોની મહદની જરૂર રહેતી નથી.

સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધો સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજફૂર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જ્યારે એ વસ્તુઓ લેતો ત્યારે મને કંઈક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઈત્યાહિમાંથી મેળવતો તેના કરતાં અધિક સામાન્ય ભાજુઓના ઊકળામાંથી મેળવું છું.

## ૭. માદક પદાર્થો

માદક પદાર્થોમાં હિનુસ્તાનમાં મહિરા, ભાંગ, ગાંજે, તમાકુ  
અને અફીણ ગણી શકાય. મહિરામાં એ હેશમાં  
૮-૧૦-'૪૨ પેહા થતાં તાડી અને 'એરક' (મહુડા) છે; અને  
પરહેશથી આવતા દાડાઓનો કંઈ પાર નથી. આ  
બધા સર્વથા ત્યાજ્ય છે. મહિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને  
એ સ્થિતિમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી  
છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યા છે.  
મહિરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.

એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદિત) પ્રમાણમાં શરાબ  
પીવાનું સમર્થન કરે છે, અને તેથી કાયદો થાય છે એમ કહે છે.  
મને એ દલીલમાં કંઈ વજૂદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલનો  
સ્વીકાર કરીએ તોપણ અનેક માણસો જે મર્યાદામાં રહી જ નથી  
શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.

તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુષ્કળ થયું છે. તેઓ  
કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડી ખોરાક છે અને  
સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ  
દલીલ મેં બહુ વિચારી છે, અને એ વિશે સારી પેઠે વાંચ્યું છે.  
પણ તાડી પીનારા ઘણા ગંરીબોની જે દુર્દીશા મેં જોઈ છે તે ઉપરથી  
હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને  
કશું સ્થાન આપવાની જરૂર નથી.

જે ગુણોનું આરોપણતાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને  
બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના  
૧-૧૦-'૪૨ રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં  
માદકતા મુદ્દલ નથી. શુદ્ધ ઇપમાં એ નીરાને નામે  
ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાંક હસ્ત  
આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર  
મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા  
વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ  
પીવા કે ખાવાની જડુર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની  
જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેઢા થાય  
છે. ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ હેશમાં  
વગર મહેનતે ઊરો છે. તે બધાંમાંથી નીરો નીકળી શકે છે. નીરો  
એવો પદ્ધતિ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઈ  
જોખમ ન વહોરવું પડે. તેમાં માદકતા જલદી પેઢા થઈ જાય  
છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઈ શકે એમ હોય ત્યાં  
તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે  
છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીના ગોળ કરતાં વધારે  
ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં  
વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામઉધોગ સંઘની મારક્ષત  
તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે  
પ્રમાણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે  
છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હિંદુસ્તાનમાં  
ગોળખાંડની તૂટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તે ભાવે ઉત્તમ  
ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી  
ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની  
કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા

નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ કારી વિનાની સાકર સમજવી. ખોરાક જેમ તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.

તાડીનું વર્ણન કરતાં સહેજે મારે નીરાનો ઉલ્લેખ કરવો પડ્યો ને તેને અંગે ગોળનો. પણ શરાબ વિશે હજુ કહેવાનું બાકી રહે છે.

શરાબથી થતી બહીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી. દક્ષિણ આંકિકામાં ગિરમીટ(અર્ધ ગુલામી)માં જ્વા હિંદીઓમાંના ધણાને શરાબ પીવાની આઢત પડેલી હોય છે, ત્યાંના કાયદા પ્રમાણે હિંદીથી શરાબ ઘેર ન લઈ જવાય, પીવો હોય તેટલો પીઠા ઉપર જઈને પીએ. જૈરાંઓ પણ તેનો બોગ થયેલાં હોય છે. તેઓની જે દરા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જેનાર કોઈ દિવસ દાર પીવાનું સર્વર્થન ન કરે.

ત્યાંના હબસીઓને સામાન્યપણે પોતાની મૂળ સ્થિતિમાં શરાબ પીવાની ટેવ નથી હોતી. તેઓનો તો દાડાએ વિનાશ જ કર્યો છે એમ કહી શકાય. ધણા હબસી મજૂરો પોતાની કમાણી શરાબમાં હોમતા જેવામાં આવે છે. તેઓનું જીવન નિરર્થક બની જય છે.

અને અંગેજેનું? સારા ગણાતા અંગેજેને પણ મેં ગાઠરમાં આપોટતા જોયા છે. આ અતિશયોક્તિ નથી. લડાઈને વખતે જેને દ્રાન્સવાલ છોડવું પડ્યું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જિનિયર હતો. શરાબ ન પીધો હોય

ત્યારે એના લક્ષણ બધા સારા હતાં. થિયોસોક્સિસ્ટ હતો. પણ તેને શરાબ પીવાની લત હતી. જ્યારે એ પીએ ત્યારે તે છેક હીવાનો થઈ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સકળ ન થઈ શક્યો.

દક્ષિણ આંહિકાથી દેશ આંધ્રાયો ત્યારે પણ દુઃખ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર ૧૦-૧૦-'૪૨ થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનિક યુવકોને પણ ઓછાવતા પ્રમાણમાં લાગુ પડે છે. મજૂર વર્ગની સ્થિતિ તપાસીએ તો તે પણ દ્વારા જનક જ છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ર્ય નહીં પામેકે હુંકેમ મધ્યપાનનો સખત વિરોધ કરું છું.

એક વાક્યમાં કહું તો મધ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ધિએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે.

## ૮. અક્ષીણ

જે ટીકા મધ્યપાનને વિશે કરી તે જ અક્ષીણને પણ લાગુ પડે છે. બે વ્યસનમાં ભેદ છે ખરો. મધ્યપાન નથો ટકે ત્યાં લગી માણસને તોકાની કરી મૂકે છે. અક્ષીણ માણસને જડ બનાવે છે. અક્ષીણી એહી બને છે, ઊંઘણશી થઈ જાય છે ને કંઈ કામનો નથી રહેતો.

મધ્યપાનનાં માઠાં ફળ આપણે રોજ નજરે જોઈ શકીએ છીએ તેમ અક્ષીણની અસર તુરત નજરે નથી ચડતી. અક્ષીણની જેરી અસર તુરત જેવી હોય તો તે ઓરિસા અને આસામમાં જોઈ શકાય છે. ત્યાં હજરો માણસો તે દુર્ઘટસનમાં ફસેલા જેવામા આવે છે. જેઓ તે વ્યસનથી ઘેરાયેલા છે તેઓ મરવાને વાંક જીવતા હોય એવા લાગે છે.

પણ અક્ષીણની સૌથી વધારે ખરાળ આસર તો ચીનમાં થયેલી કહેવાય છે. ચીનાઓનાં શરીર હિંદુસ્તાનીના કરતાં વધારે મજબૂત હોય છે. પણ જેઓ અક્ષીણના પાશમાં પડ્યા છે તે મણ જેવા જોવામાં આવે છે. જેને અક્ષીણની લત લાગી છે તે હીનહીન બની જય છે ને અક્ષીણ મેળવવાને સારુ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જય છે.

ચીન અને અંગ્રેજ વચ્ચે લડાઈ થયેલી તે અક્ષીણની લડાઈને નામે ઓળખાય છે. ચીનને હિંદુસ્તાનનું અક્ષીણ નહોતું જોઈતું, જ્યારે અંગ્રેજને ચીન સાથે તે અક્ષીણનો વ્યાપાર કરવો હતો. આ લડાઈમાં હિંદુસ્તાનનો પણ દોષ હતો. હિંદુસ્તાનમાં કેટલાક હિંદી અક્ષીણના ઈજરદાર હતા. તેમાંથી કમાણી સારી પેઠે થતી હતી. હિંદુસ્તાનની મહેસૂલમાં ચીનથી કરોડો રૂપિયા આવતા હતા. આ વેપાર પ્રત્યક્ષ રીતે અનીતિનો હતો, છતાં ચાલ્યો. છેવટે ઈંગ્લાંડમાં મોટું આંદોલન ભાગ્યું ને અક્ષીણનો વેપાર બંધ થયો. આમ જે વસ્તુ પ્રજાનો નાશ કરી શકે છે તેનું વ્યસન કાળવાર પણ સહન કરવા જેવું નથી.

આટલું કહ્યા પછી એમ કબૂલ કરવું જોઈએ કે, વૈદકશાલ્કમાં  
અક્ષીણને બહુ મોટું સ્થાન છે. તે એવી દવા છે  
૧૧-૧૦-'૪૨ કે જેના વિના ન ચાલી શકે. એટલે અક્ષીણનું  
વ્યસન મનુષ્ય સ્વેચ્છાએ છોડી હે એટલે ઊચે  
સ્થાને પહોંચશો; ત્યારે પાળ વૈદકશાલ્કમાં અક્ષીણનું સ્થાન રહી  
જવાનું છે. પણ જે વસ્તુ દવા તરીકે આપણે લઈ શકીએ છીએ  
એ આપણે વ્યસન તરીકે થોડી જ લઈ શકીએ છીએ? લેવા જઈએ  
તો એ જ જેરદરપ થઈ પડે છે. અક્ષીણ તો પ્રત્યક્ષ જેર છે જ,  
એટલે વ્યસનરૂપે સર્વથા ત્યાજ્ય છે.

## ૬. તમાકુ

તમાકુએ તો આડો આંક વાળયો છે. તેના પંજામાંથી ભાગ્યે જ કોઈ છૂટે છે. આખું જગત એક કે બીજે ઇપે તેનું સેવન કરે છે. ટોલ્સ્ટોયે તો તેને બધાં વ્યસનોમાં ખરાળ ગાણાવી છે. એ અધિનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમ કે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બન્નેના ગેરકાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબૂલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરિણામો પ્રત્યક્ષ ઇપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું છું કે, એનો કાયદો હું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઉતરે છે એ હું આખું છું. એક અંગ્રેજ મેજિસ્ટ્રેટ તમાકુ ઉપર ૬૨ માસે પાંચ પાઉન્ડ એટલે ૩. જ્યે ખર્ચતો હતો. એનો પગાર ૬૨ માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ૮૫) ધુમાડામાં જતો હતો.

તમાકુ પીનારની વૃત્તિ એવી બુઢી થઈ જય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ધાણે ભાગે પડોશીની લાગણીનો વિચાર નથી કરતો. તમાકુ પીનારને (આનારને) ધાણે ભાગે થૂંકવું પડે છે. તે ગમે ત્યાં થૂંકતાં સંકોચાતો નથી.

તમાકુ પીનારના મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સૂક્ષ્મ લાગણીઓ મરી જય છે. એ મારવાને આતર માણસ તમાકુ પીતો થયો હોય એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જતનો

કેક ચડે છે અને તે કેકમાં માણસ પોતાની ચિંતા કે પોતાનું હુઃઅ ભૂલે છે. ટોલ્સ્ટોયે પોતાના એક પાત્ર પાસે ધોર કામ કરાયું તેના પહેલાં તેને શરાબ પિવડાયો. તેને કરવું હતું ભયંકર ખૂન શરાબની અસર થતાં છતાં તે ખૂન કરતાં સંકોચાય છે. વિચાર કરતો કરતો સિગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઊંચે ચડતો ધુમાડો નિહાળે છે, ને બોલી ઉઠે છે: “હું કેવો બીકણ છું! ખૂન કરવું એ કર્તાય છે તો પછી સંકોચ શો? ચાલ ઉઠ ને તારુ કામ કર.” એમ તેની ડોળાયેલી બુદ્ધિએ તેની પાસે નિર્દોષ માણસનું ખૂન કરાયું. હું જાણું છું કે આ હલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરાડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વિતાડે છે એમ કહી શકાય. છતાં વિચારવાને મજફૂર દાટાંતનું મનન કરવું ઘટે છે. ટોલ્સ્ટોયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર જીણાં જીણાં પાપો કર્યા કરે છે.

હિનુસ્તાનમાં આપણે તમાકુ કૂંકીએ છીએ એટલું જ નહીં પણ તે સૂંધીએ છીએ, ને જરદાને રૂપે ચાવીએ પણ છીએ. કેટલાક અમે માને છે કે, તમાકુ સૂંધવાથી લાભ થાય છે. વૈધ હકીમની સલાહથી તેઓ તમાકુ સૂંધે છે. મારો અલિપ્રાય છે કે તેની કશી જરૂર નથી. તંદુરસ્ત માણસને આવી જરૂર ન જ હોવી જોઈએ.

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ કૂંકવી, સૂંધવી અને આવી એ ત્રણમાં આવી એ સૌથી વધારે ગંધી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ બમણા છે.

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખૂણો; પીએ તેનું ધર ને સૂંધે તેનાં લૂગડાં એ ત્રણે બરાબર.

જરદો ચાવનાર સાવધાન હોય તે થુંકદાન રાખે છે ખરા, પણ ઘણાઓ પોતાના ઘરના ખૂણામાં અથવા હીવાલ ઉપર થુંકતાં શરમાતા નથી. પીનાર ધુમાડાથી પોતાનું ઘર ભરી મૂકે છે અને છીડણી સૂંધનાર પોતાનાં કપડાં બગાડે છે. કોઈ પોતાની પાસે ઇમાલ રાખે છે તે અપવાદ્દર્પે છે. જેઓ આરોગ્યના પૂજારી છે તે દફ મન કરીને ગમે તે વ્યસનની ગુલામીમાંથી નીકળી જશે. ઘણાને આમાંના એક, બે કે ત્રણેય વ્યસન હોય છે, એટલે તેને સૂગ નથી ચડતી. પણ જો શાંત ચિંતે વિચાર કરીએ તો કુંકવાની કિયામાં કે લગભગ આખો દહાડો જરદા કે પાનબીડાં વગેરેથી ગલોકાં ભરી રાખવામાં કે તમાકુની દાબડી ખોલી સૂંધવામાં કંઈ શોભા નથી. એ ત્રણે વ્યસનો ગંદાં છે.

## ૧૦. બ્રહ્મચર્ય

બ્રહ્મચર્યનો મૂળ અર્થ જે વડે બ્રહ્મ મળે તેવી ચર્ચા. સંયમ વિના બ્રહ્મ મળે જ નહીં. સંયમમાં સર્વાપરી ઈન્દ્રિયનિગ્રહ છે. સામાન્યપણે બ્રહ્મચર્ય એટલે લીસંગ ન કરવો ને વીર્યસંગ્રહ સાધવો. સર્વ ઈન્દ્રિયોના સંયમ કરનારને વીર્યસંગ્રહ સહજ ને સ્વાભાવિક થઈ પડે છે. સ્વાભાવિક રીતે થયેલો વીર્યસંગ્રહ જ ધારેલું ફળ આપે છે. એવો બ્રહ્મચારી કોધાદિથી મુક્ત હોય, જ્યારે ઘણા કહેવાતા બ્રહ્મચારી કોધી ને અહંકારી જોવામાં આવે છે. કેમ જાણો તેઓને કોધ કરવાનો, અભિમાની થવાનો ઈજારો મળ્યો હોય નહીં!

એમ પણ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યના પાલનના સામાન્ય નિયમોની અવગાળના કરીને તેઓ કેવળ વીર્યસંગ્રહ કરવાની આશા રાખે છે. તેઓ નિરાશ થયા છે ને કેટલાક તો હીવાના જેવા બને છે. બીજ નિસ્તેજ જોવામાં આવે છે. તેઓ વીર્યસંગ્રહ કરી શકતા

નથી ને કેવળ લીસંગ ન કરવામાં સક્ષિપ્ત થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. લીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જ્યાં લગી લીસંગમાં રસ રહ્યો છે ત્યાં લગી બ્રહ્મચર્યપ્રાપ્તિ થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે લીએ જ પોતાની જનનેન્દ્રિય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી. ખરા બ્રહ્મચારીની વાણીમાં, વિચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.

આંદું બ્રહ્મચર્ય લીઓની સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડારો નહીં. એવા બ્રહ્મચારીને સારુ લીપુરુષનો બેદ નહીંવતું થઈ જય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવામાં કહી ન થાય. જેની વિષયાસક્તિ બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં લીપુરુષનો બેદ ટળી જય છે, ટળવો જોઈએ. તેના ખૂબસૂરતીના ખ્યાલ જુદું જ ઇપ પકડે છે. તે બહારના આકારને જોશો જ નહીં. જેના આચાર ખૂબસૂરત છે તે લી હો કે પુરુષ ખૂબસૂરત છે. તેથી ઇપાળી લીને જોઈને તે વિહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રિયે પણ જુદું ઇપ લીધું હશે, એટલે કે તે સદ્ગારને માટે વિકારરહિત થશે. એ વીર્યહીન થઈ નપુંસક નહીં થાય, પણ તેના વીર્યનું પરિવર્તન થવાથી તે નપુંસક જેવો લાગશે. નપુંસકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનેન્દ્રિયની જગૃતિ ઈચ્છે છે પણ તેની જગૃતિ નથી થતી છતાં લાવ થઈ જય છે. રસ રહ્યા છે તેથી તે બહયા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુંસક થયા છે; અથવા તે નપુંસક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દ્વારા મણી સ્થિતિ છે. પણ પોતાના

રસ બળી જવાથી જે ઉદ્ઘરિતા થયા છે તેનું નપુંસકત્વ સાવ જુદું જ છે અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા અહિચર્યારી જવલ્લે જ મળો છે. અહિચર્ય-પાલનનું મારું ક્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાપ્તયાને પૂર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દાખિયે મારી પ્રગતિ સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પૂર્ણ સકળતા હેઠ પડ્યા પહેલાં પણ મળો. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. અહિચર્યની આવર્ષયકતા વિશેના મારા વિચાર વધારે ૯૬ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મૂકવા જેટલી સ્થિતિએ નથી પહોંચ્યા. જે મને સંતોષ થાય તેટલે અંશો સકળ થશે તો તે સમાજની પાસે મૂકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સકળતાથી પૂર્ણ અહિચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.

આ પ્રકરણમાં જે અહિચર્યની ઉપર હું ભાર હેવા માગું છું તે વીર્યરક્ષા પૂરતું છે. પૂર્ણ અહિચર્યના જે અમોદ્ય ૧૧-૧૨- ૧૩ લાભ છે તે આમાંથી નહીં મળો. છતાં તેની ડિમત જેવી તેવી નહીં હોય. અના વિના પૂર્ણ અહિચર્ય અસંભવિત છે. અને અના વિના, એટલે વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ત સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેઢા કરતી શક્તિ છે તે વીર્યનું કોકટ સખલન થવા હેવું એ મારી અજાનની નિશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રાણેત્પત્તિને સારુ છે, એ પૂર્ણપણે સમજાય તો વિપ્યાસક્તિને સ્થાન જ નથી રહેતું. ખ્રીપુરુષ-સંગમ પાછળા અન્ને નરનારી પછડાઈ મરે છે તે અંધ થાય, વિવાહનો અર્થ અદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને લિરસડાર છુટે. વિવાહ એ ખ્રીપુરુષ વર્ચયેના હાર્દિક અને આત્મિક

એકચની નિશાની હોવો જોઈએ, વિવાહિત લીપુરૂપ પૂર્ણ અભ્યારી ગણાવાને લાયક છે, જે તેઓ પ્રજોતપત્તિના શુદ્ધ કારણ વિના કહી સંગ કરવાનો વિચાર જ ન સેવે તો. એવો સંગ બનેની ઈચ્છા થતાં જ સંભવે. એ સંગ આવેશમાં ન થાય. કામાળિન શાંત કરવાને કહી નહીં. સંગને કર્તવ્ય માની તે થયા પછી ફરી સંગની ઈચ્છા સરખી ઉત્પન્ન ન થવી જોઈએ. આ લાગાણને કોઈ હાસ્યજ્ઞનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર ચાહ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વિરુદ્ધ આ લાગાણ જય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતિ સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી હીવાસળી ને હીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતિક વસ્તુને લાગુ પડે છે તે આત્મિકને પણ લાગુ પડે છે. પૂર્વ વિવાહ જેવી વસ્તુ જ ન હતી. લી-પુરૂપ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસિક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમધર્મ શોધ્યો. એ સંયમધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધિકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કંડવું કે, મનુષ્યનું કર્તવ્ય લી-પુરૂપ-સંગને હું સૂચવું છું તે કક્ષાને પહોંચવાનું છે, તે હસી કાઠવા જોગ નથી. તે સાથે મારું એ પણ સૂચન છે કે, જે મનુષ્યજીવન જેમ ઘડવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ થવી જોઈએ.

નિત્ય ઉત્પન્ન થતા વીર્યનો પોતાની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક શક્તિ વધાર્યામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી

પોતાના શરીરને બાંધી શકશો. અહુપાહારી હોવા છતાં તે શારીરિક અમભાં કોઈથી ઉત્તરશો નહીં. માનસિક અમભાં તેને ઓછામાં ઓછો થાક લાગશો. ઘડપણનાં જે ચિહ્ન આપણે જોઈએ છીએ તે આવા અહુચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તિ ધરાવતો છતો ખરી પડશો. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ હેખાય, પણ તેની બુદ્ધિ ક્ષીણ થવાને બદલે નિત્ય વિકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચિહ્ન જેને વિશે ન જોવામાં આવે તેના અહુચર્યાર્થમાં તેટલી ન્યૂનતા સમજવી. તણે વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ અધું સાચું હોય—ને મારો દાવો છે કે સાચું છે—તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.

વીર્યસંગ્રહના થોડા મોટા નિયમો જોવા હું જાણું છું તે અહીં આપું છું :

૧. વિકારમાત્રની જડ વિચારમાં રહેલી છે, તેથી વિચારો ઉપર કાયુ મેળવવો. એનો ઉપાય એ છે કે, મનને ૧૨-૧૨-૧૪૨ આલી ન રહેવા હેવું, સારા ને ઉપયોગી વિચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વિશે ફિકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નિપુણતા મળે એ વિચારવું ને તેનો અમલ કરવો. વિચાર અને તેનો અમલ વિકારોને રોકશો. પણ આપો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ મારો છે, રાતના ઊંઘ નથી આવતી, ત્યારે વિકારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે દૃપે અનુભબ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે દૃપને હદ્દ્યમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ મનમાં

ન હોવું જોઈએ. આ આર્થિક સ્થિતિ છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વિચારો ચર્ચાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રજ્ઞપૂર્વક જ્યું જર્ખ્યા કરવો. તેને અંતે વિજય છે જ એમ નિશ્ચયપૂર્વક માનવું એટલે વિજય થશે જ.

૨. વિચાર તેમ વાચા ને વાચન વિકારોને શમાવનારાં હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્તસ વિચાર ન આવે તેને મુખેથી બીભત્તસ બોલી નીકળો જ નહીં.

વિષયને પોષનારું બહોળું સાહિત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન હેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણિતાહિને અહીં મોઢું સ્થાન છે. હેખીતું છે કે જે વિકારોનું સેવન નથી ઈચ્છતો તે વિકારને પોષે એવા ધંધાનો ત્યાગ સેવશે.

૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ — એવું કે રાત પડ્યે માળસને જે સુંદર થાક ચેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નિદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નિદ્રા શાંત અને નિઃસ્વઅ હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત ન જ સાંપ્રે તેવાઓએ અચૂક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે કરવાની છે. કરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં, બેસતાં શરીર ટટાર જ હોય. જેમ તેમ બેસવું કે ચાલવું એ આળસની નિશાની છે. આળસમાત્ર વિકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, આંખ, કાન, નાક, જીબ ઈત્યાહિ પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રિય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવવાક્ય સૌ ડોઈ માને એવી આશા રાખું છું.

૪. જેવો આહાર તેવો આકાર. જે માણસ અત્યાહારી છે, જેના આહારમાં કશો વિવેક નથી, તે પોતાના વિકારોનો ગુલામ છે. જે સ્વાહને ન જીતે તે ઈદ્રિયજિત કહી નહીં થઈ શકે તેથી માણસે યુક્તાહારી ને અલ્પાહારી બનવું ધ્યે છે. શરીર આહારને સારુ નથી, પણ આહાર શરીરને સારુ છે. અને શરીર પોતાને ઓળખવા સારુ બનયું છે. પોતાને ઓળખવો એટલે ઈશ્વરને ઓળખવો. એ ઓળખને જેણે પોતાનો પરમ વિષય બનાવ્યો છે, તે વિકારોને વશ નહીં થાય.

૫. પ્રત્યેક લીને ભાતા, બહેન કે દીકરી તરીકી જેવી. કોઈ પુરુષ પોતાની ભા, બહેન કે દીકરી ઉપર વિકારી નજરે નહીં જુદે. લી પ્રત્યેક પુરુષને પિતા, ભાઈ કે દીકરા તરીકી જુદે.

મારાં બીજાં લખાણોમાં મેં વધારે નિયમો આપ્યા છે તે બધાનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે. તેનું પાલન કરનારને સારુ મહાન વિકારને જીતવો બહુ સહેલું થઈ પડવું જોઈએ. જેને બ્રહ્મચર્ય પાળવાની ધગશ છે તે, એ પાલન અસંભવિત છે અથવા કરોડોમાંથી કોઈક જ પાળી શકે, એમ માનીને તેનો પ્રયત્ન નહીં છોડે. જે રસ તેના પાલનમાં છે તે બીજી કશી વસ્તુમાં નથી. હું બીજી રીતે કહું તો એમ કહેવાય કે, જે આનંદ ખરી રીતે નીરોગી શરીર ભોગવે છે તે આનંદ બીજી કશી વસ્તુમાં નથી, ને કોઈ શરીરને તે નીરોગિતા નહીં સાંપડે જે વિકારનું ગુલામ છે.

**કૃત્રિમ અંકુશઃ** હવે કૃત્રિમ ઉપાયો વિશે થોડું લખ્યું. ભોગ ભોગવતાં છતાં કૃત્રિમ ઉપાયોથી પ્રજોત્પત્તિ અટકાવવાની પ્રથા જૂની છે. પણ પૂર્વે તે છૂપી રીતે ચાલતી. આ સુધારાના જમાનામાં તેને ઊંચું સ્થાન મળ્યું છે, ને ઉપાયો પણ પદ્ધતિસર રચાયા છે. એ પ્રથાને પરમાર્થની ઓઠણી ઓઠાડવામાં આવી છે. તેના

હિમાયતી કહે છે કે, ભોગોચછા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષિસને નામે પણ ઓળખાવાય. તેને કાઠવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મૂકવો મુશ્કેલ છે. અને જે સંયમ સિવાય બીજે કોઈ ઉપાય ન યોજવામાં આવે તો અસંપ્રય લીઓની ઉપર પ્રજ્ઞેતપત્તિનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજ્ઞ એટલી વધી પડે કે મનુષ્યજ્ઞતિના સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તિઓને અટકાવવા સારુ કૃત્રિમ ઉપાયો યોજવાનો માનવર્ધમં થઈ પડે છે. મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજુ ઉપાધિઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકસાન તો એ છે કે, સંયમર્ધમનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલિક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પણ આ સ્થાને હું દલીલમાં ઉિતરવા નથી દૂરુંતો. જિજાસુને મારી ભલામણ છે કે તે નીતિનાશને માર્ગ નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધિ જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની દૂરુંતો કે કુરસદ ન હોય તે ભૂલેચૂકે પણ આ કૃત્રિમ ઉપાયોની પડખે ન ચઢે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નિર્દોષ આનંદનાં ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગ જાય, બન્ને ઊંચે ચઢે એવાં કાર્યો શોધે, કે જેમાંથી વિષયવાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે. શુદ્ધ ત્યાગના થોડા અલ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વિષય ભણી જવા જ નહીં હે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વિચારશુદ્ધિથી નથી થતો પણ કેવળ બાહ્યાચારને રોકવાના શોકટ પ્રયત્નથી થાય છે. વિચારની દફ્તાની સાથે આચારનો સંયમ શરૂ થાય તો સકળતા મળ્યા વિના ન જ રહે. લીપુરુષની જોડી વિષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.

## આરોગ્યની ચાવી

ભાગ બીજે

### ૧. પૃથ્વી એટલે માટી

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્જિક ઉપચારોનું મહત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેળેવી રીતે કર્યો ૧૩-૧૨-૧૫૨ છે એ બતાવવાનો છે. એ વિશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વિસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરૂપી પૂતળું બન્યું છે, તે જે નૈસર્જિક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સૂર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો કમપૂર્વક ઉપયોગ સૂચવવાનો આ પ્રયત્ન છે.

સન ૧૯૦૧ની સાલ લગી મને કંઈક વ્યાધિ થાય તો હું દાક્તરોની પાસે તો ન ઢોડતો, પણ તેઓની દ્વાનો થોડો ઉપયોગ કરતો. એક-બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફૂટ સોલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું હુઃખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દ્વા લોહ (ગયલાઈજ્રડ) અને નક્સવામિકા લેતો. દ્વાઓ ઉપર વિશ્વાસ ઘણો ઓછો હતો. એટલે એ ન ચાલતાં જ લેતો. તેથી સંતોષ ન થતો.

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્જિક ઉપચારોમાં મને સારી પેઠે વિશ્વાસ હતો, પણ કોઈની

મહા ન હતી. છુંછવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના કેરકાર ઉપર નભતો. પુષ્કળ કરવાનું રાખતો તેથી કોઈ હિવસ ખાટલો સેવવો નહોતો પડચો. આમ મારું રગશિયું ગાંદું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું રિન્ન નું નેચર નામનું પુસ્તક બાઈ પોલાડે મારા હાથમાં મૂક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશો લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજ્ઝર પુસ્તક મૂક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મૂક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાક માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેદું ઉપર મૂકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વિના પેદું ઉપર મૂકવાની છે, પણ મેં તો જીણા કપડામાં જેમ પોલ્ટીસ મૂકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેદું ઉપર રાખી. સવારે ઊઠચો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે હિવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફૂટ સોલ્ટને ભાગ્યે જ અડચો હોઈશ. જરૂર જણાયે કોઈક વાર એરાંદિયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીની લોપરી ત્રણ ઈચ્છ પહોળી અને છ ઈચ્છ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જડી અથવા અડધો ઈચ્છ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને એરી સાપ ઉંઘ્યો હોય તેને જે માટીનો ખાડો કરી (માટીથી ટાંકીને) તેમાં સુવાડવામાં આવે તો તે એર ઊતરે છે. એવો દાવો સામિત થાઓ કે ન થાઓ, પણ મેં જતે જે ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉ. માથું હુખતું હોય તો માટીની લોપરી મૂકવાથી ઘણે ભાગે કાયદો થયેલો મેં અનુભંગ્યો છે. સેકડોની ઉપર આ પ્રયોગ કર્યો છે. માથું હુખવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું હુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલિક લાભ તો આપે જ

છે. સામાન્ય કોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા કોડા ઉપર પણ મેં તો માટી મૂકેલી છે. એવા કોડા ઉપર મૂકવાને સારુ સાઝ કપું લઈ તેને હું પરમેન્ગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને કોડાને સાઝ કરીને ત્યાં માટીની લોપરી મૂકું છું. ઘણે ભાગે કોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નિષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ઊખમાં માટી તુરત જવાબ આપે છે. વીછીના ઊખમાં મેં માટીનો ખૂબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીછીનો ઉપદ્રવ હંમેશાની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજે ત્યાં રાખ્યા છે. કોઈને વિશે એમ ન કહી શકું કે તે તો અચૂક કાયદો કરે જ છે. કોઈ ઈલાજેથી માટી ઉત્તરતી નથી એટલું કહી શકાય.

સખત તાવમાં માટીનો ઉપયોગ પેદું ને માથા ઉપર, જે માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો  
 ૧૪-૧૨-'૪૨ છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતિ તો થઈ જ છે. ટાઈકોઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તો તેની મુદ્દતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતિ આપી છે, ને બધા દરદીએ માટી માંગી લીધી છે. સેવાગ્રામમાં હસેક કેસ ટાઈકોઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈકોઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજી નૈસર્જિક ઉપયારો કર્યા છે ખરા. તે એને સ્થળે આપવા ધારું છું.

માટીનો ઉપયોગ છૂટથી એન્ટીઇલોજિસ્ટીનને બહલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસિયું) લેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બિલકુલ નિર્દોષ બની જાય છે.

માટી કેવી હોવી જોઈએ એ કહેવાનું રહે છે. મારો પ્રથમ પરિચય તો ચોળખી લાલ માટીનો હતો. પાણી મેળવવાથી એમાંથી સુગંધ છૂટે છે. આવી માટી સહેજે મળતી નથી. મુંબઈ જેવા શહેરમાં તો કોઈ પણ પ્રકારની માટી મેળવવી મને તો મુશ્કેલ પડ્યું છે. માટી ચીડણી ન હોવી જોઈએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુવાળી રેશમ જેવી હોવી જોઈએ. તેમાં કાંકરી ન હોવી જોઈએ તેથી એ છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઈએ. તદ્દન સાંક ન લાગે તો માટીને શેકવી. માટી છેક સૂકી હોવી જોઈએ. ભીની હોય તો તેને તઢકે કે અંગાર ઉપર સુકવવી. સાંક ભાગ ઉપર વાપરેલી માટી સુકવી નાખ્યા પછી વારંવાર વાપરી શકાય છે. આમ વાપરવાથી માટીનો કોઈ ગુણ ઓછો થતો હોય તો હું જણતો નથી. મેં આમ વાપરી છે ને તેનો ગુણ ઓછો થયો એવું અનુભવયું નથી. માટીનો ઉપયોગ કરનારાઓ તરફથી સાંભળ્યું છે કે, જમનાને કિનારે પીળી માટી મળે છે તે બહુ ગુણકારી છે.

સાંક ઝીણી દરિયાઈ રેતી એક બરની ખાવાનો પ્રયોગ હસ્ત લાવવાને સારુ કરાય છે, એમ કચુનેએ લાખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે: માટી કંઈ પચતી નથી. એને તો કચરાની જેમ બહાર નીકળવાનું જ છે. તે નીકળતા મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગો કરવા ધારે તેણે વિચારપૂર્વક પ્રયોગ કરવો. એક-બે વેળા અજમાવી જેવાથી કંઈ નુકસાન થવાનો સંભવ નથી.

## ૨. પાણી

પાણીના ઉપચાર જાળીની તેમ જ પુરણી વસ્તુ છે. તેને વિશે ઘણાં પુરસ્તકો લગાયા છે. કચુનેથે તેનો ઉત્તમ ઉપયોગ શોષણો છે. એનું પુરસ્તક હિનુસ્તાનમાં બાજુ પ્રસિદ્ધિને પાડ્યું છે. તેનો તરજુમો પણ આપણી ભાષાઓમાં થયો છે. એના વધારેમાં વધારે અનુભાવી વાંધ હેશમાં મળે છે. કચુનેથે ગોરાક વિશે પણ આરી એઠે લખ્યું છે. અહીં તો હું માત્ર પાણીના ઉપચારો ઉપર જ લગ્યા ધારો છું.

કચુનેના ઉપચારોમાં મહાયંિંહુ કટિસ્નાન અને ધર્ષણાસ્નાન છે. તેને સારુ તેણે ખાસ વાસણ પણ થોડ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના ૫૬ પ્રમાણે જીસથી ૭૨૩૮ હિંચનું ૪૮ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઈએ તો મોટું લેવું. તેમાં હુંકું પાણી ભરવું. ઉનાળામાં ખાસ હુંકું રાખવાની જરૂર છે. તુરત હુંકું કરવું હોય તો, ને મળે તો, થોડો બરદાસ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં કારેલું પાણી બરોબર કામ આપે છે. ૪૮માં પાણી ઉપર કપું હાંકી જપાટાવંધ પંખો કરવાથી તુરત હુંકું કરી શકાય.

૪૮ લીંતને અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબું પાટિયું રાખવું, જેથી તેને અઢેલીને હરહી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને હરહી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ફાડેલો હોવો જોઈએ, જેથી હંડી ન વાય. જે કોટડીમાં ૪૮ રાખવામાં આવે તેમાં હવાની આવજ અને અજવાણું હોવાં જ જોઈએ. હરહીના આરામપૂર્વક બેઠા પછી તેના પેહુ ઉપર એક નરમ દુવાલ વતી ધીમું ધર્ષણ કરવું. પાંચ મિનિટથી જીસ મિનિટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી બીનો ભાગ

સૂક્ષ્મવીને દરદીને સુવાડી હેવો જોઈએ. આ સ્નાન ધણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકસાન તો છે જ નહીં, અને લાલ પ્રત્યક્ષ ભળે છે. સ્નાન ભૂખ્યે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન કાયદો કરે છે. અજીણની મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટીસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સકળ થયો છે એમ નહીં કહી શકું, પણ સોમાંથી પંચોત્તેર ટકામાં સકળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થિતિ હોય તો, તાવ બે-ત્રણ હોરા તો જ૩૨ ઉત્તરશે. સન્નિપાતનો ભય મટશે.

આ સ્નાનને વિશે કચુનેની દલીલ આ છે : રોગનું ગમે તે બાહ્ય ચિહ્ન હોય, પણ તેનું આંતરિક કારણ એક જ હોય છે. આંતરડાનો તાવ અંદરની ગરમીને અનેક રૂપે બહાર પ્રગટાવે છે. આ આંતરિક તાવ કટીસ્નાનથી અવશ્ય ઉતરે છે ને તેથી બહારના અનેક ઉપદ્રવો શાંત થાય છે. આ દલીલમાં કેટલું તથ્ય છે એ હું ન કહી શકું. એ તો અનુભવી દાક્તરો બતાવી શકે. પણ, જોકે નૈસર્જિક ઉપચારોમાંથી કંઈ દાક્તરોએ લીધેલું છે છતાં એમ કહી શકાય કે એ ઉપચારો વિશે તેઓ ઉદાસીન રહ્યા છે. આમાં બન્ને પક્ષના હોષ હું જેઓ છું. દાક્તરો પોતાની શાળા વાટે જે શીખે તે જ જેવાની ટેવ કેળવે છે, એટલે બહારનું જે હોય તેને વિશે તિરસ્કાર

નહીં તો ઉદાસીનતા તો અવશ્ય બતાવે છે.

૧૫-૧૨-૧૪૨ નૈસર્જિક ઉપચારકો દાક્તરોને વિશે તિરસ્કાર કેળવે છે, અને પોતાની પાસે શાલીય જ્ઞાન ધણું ઓછું હોવા છતાં દાવો બહુ મોટો કરે છે. ઉપચારકો સંઘશક્તિ કેળવતા નથી. કેમ કે સહુને પોતાની પાસે રહેલી મૂડીથી સંતોષ

છ. તેથી બે સાથે ભળીને કામ નથી કરી શકતા. કોઈના પ્રયોગ ઉડ જતા નથી. કોઈ નખતા કેળવતા નથી. (નખતા કેળવી શકાતી હુશે ખરી ?) આમ કહીને હુ નૈસર્જિક ઉપચારકોને વગોવવા નથી દુચ્છતો. વસ્તુસ્થિતિ બતાવું છું. જ્યાં સુધી એઓમાંથી કોઈ અત્યંત તેજસ્વી માણસ ઉત્પન્ન નહીં થાય ત્યાં લગી સ્થિતિ બદ્લાવાનો સંભવ થોડો છે. સ્થિતિ બદ્લાવાનો બોણે ઉપચારકો ઉપર છે. હાકતરો પાસે પોતાનું શાખ છે, પોતાની પ્રતિષ્ઠા છે, પોતાનો સંધ છે, પોતાની શાળાઓ છે. અમુક અંશે સફળતા પણ મળે છે. તેઓ પાસેથી અજાણી વસ્તુ એકાએક ગ્રહણ કરવાની આશા ન રાખવી ધેટે.

દરમ્યાન સામાન્ય માણસે આટલું સમજુ લેવું બસ છે. નૈસર્જિક ઉપચારના ગુણ તેના નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે એટલે અણઘડ માણસ નિશ્ચિંતપણે તેનો ઉપયોગ કરી શકે છે. માથું દુખ્યું તો ટાઢા પાણીમાં બોળીને ભીનો ઝમાલ માથે મૂકવામાં નુકસાન થાય જ નહીં. માટીનો ઉપયોગ ઉમેરી ભીનાશની ઉપયોગિતામાં આપણે વધારો કરી શકીએ.

હવે ધર્ષણસ્નાન ઉપર આવું. જનનેન્દ્રિય બહુ નાજુક ઈન્દ્રિય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઈક અદ્ભુત વસ્તુ રહેલી છે. તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઈને કયુનેએ કહ્યું છે કે, ઈન્દ્રિયોના છેડા ઉપર (પુરુષના કેસમાં ધૂમર ઉપર ચામડી ચડાવી લઈને) તેની ઉપર નરમ ઝમાલ ભીજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતિ આમ બતાવી છે: ટબમાં પાણીની સપાટીથી થોડે ઊંચે તેની બેઠક આવે એવું સ્ફૂર્ત મૂકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઈન્દ્રિયના છેડાનું ધર્ષણ કરવું. જરાય ઈજ ન થવી

જોઈએ. કિયા ગમવી જોઈએ. આ ધર્માંથી સ્નાન લેનાને ઘણી શાંતિ મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને કચુનેએ કટીસ્નાન કરતાં ઉંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનનો થયો છે તેટલો ધર્માંસ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આગસ કર્યું છે. જેઓને તે ઉપચાર સૂચય્યા છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો એટલે પરિણામને વિશે અનુભવથી કંઈ નથી લખી શકતો. સૌચે આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીનું તેથી ધર્માંસ્નાન લઈ શકાય. તેથી શાંતિ તો વળશે જ. આગસ આ ઈન્દ્રિયની સક્ષાઈ ઉપર બહુ ઓછું ધ્યાન આપે છે, જ્યારે ધર્માંસ્નાનથી એ ઈન્દ્રિય સહેજે સાઝ તો થશે જ. ચીવટ ન રખાય તો ધૂમટને ટાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પૂરી જરૂર છે. એ ઈન્દ્રિયના આવા સહઉપ્યોગથી, એને વિશે કાળજી રાખવાથી બ્રહ્મર્યાંપાલનમાં મદદ મળે છે. આસપાસના તંતુઓ મજબૂત અને શાંત થાય છે; અને ઈન્દ્રિય વાટે શોકટ વીર્યસાવ ન થવા હેવાની ચીવટ વધે છે, કેમ કે એમ આવ થવા હેવામાં રહેલી ગંદકી વિશે મનમાં અણગમો પેદા થાય છે, — થયો જોઈએ.

આ બે ખાસ કચુનેનાં સ્નાન કહીએ. ત્રીજું ડેટલેક અંશો એવી જ અસર પેદા કરનારું ચાહરસ્નાન છે. તાવ આવતો હોય અથવા જેને નિદ્રાકેમેય ન આવતી હોય તેને આ સ્નાન ઉપયોગી છે.

ખાટલા ઉપર બે-ત્રણ ઊની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જડી સુતરાઉ ચાદર,—જેવો કે જડી ખાદીનો ચોકાળ — પાથરવી; તેને ઠંડા પાણીમાં બોળી ખૂબ

નિયોવવી ને તે કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવાડવો. તેનું માથું કામળ બહાર તહિયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નિયોવેલો દુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળના છેડા ને ચાહર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાહરની અંદર હોય, પગ પણ બરોબર ચાહર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર ન જવા પામે. આ સ્થિતિમાં દરદીને એક-બે મિનિટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ધશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ધર ન કર્યું હોય તો પાંચેક મિનિટમાં ધામ થઈને પસીનો છૂટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાહરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છૂટતો પણ દરદી સૂઈ જાય છે. સૂઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઊંઘ સૂચવે છે કે તેને ચાહરસ્નાન આરામ આપે છે. ચાહરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે ઊતરે જ છે. સન્નિપાતમાં ધેરાયેલા બેવડા ન્યુમોનિયાવાળા મારા દીકરાને મેં ચાહરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દિવસ આપ્યા પછી તાવ હઠયો ને પસીને રેબજેબ થયો. તેનો તાવ છેવટે ટાઈઝોઇડ નીવડયો ને ૪૨ દિવસે તાવ ઊતર્યો. ચાહરસ્નાન તો ૧૦૬ ડિગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દિવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનિયા ગયો ને પછી ટાઈઝોઇડિપે ૧૦૩ લગી જતો. અંશ (ડિગ્રી) વિશે મને સ્મરણશક્તિ છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મિત્રોની સામે થઈને મેં કરેલો. હવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહૃથી વધારે ખડતલ છે.

આ વાહરસનામ શરીરમાં અપાઈ થઈ હોય, શીળસ ગણું હોય,  
બાજુ થણ આવતી હોય, અછાડા નીકળયા  
૧૯-૧૨-'૪૮ હોય, માતા નીકળયાં હોય તેમાં પણ કામ આપે  
છે. એ આ ફરહોમાં વાહરસનાનનો છૂટથી  
ઉપયોગ કર્યો છે. શીતળા કે અછાડામાં મે પાણીમાં ગુલાબી  
રણ આવે એટલું પરમેનોનેહ નાખેલું. વાહરનો ઉપયોગ થયા પછી  
તેને ઉકળતા પાણીમાં ભોળી, પાણી નવશોકું થયા પછી બરોબર  
ખોઈ નાખવી જોઈલે.

લોહીનું ફરણું મંહ થઈ ગણું હોય ત્યારે, પગમાં બહુ કળતર  
થતી હોય ત્યારે બરદી ધસવાથી ઘણો કાયહો થયેલો જોયો છે.  
બરદના ઉપયાસની અસર ઉનાળામાં વધારે સારી રીતે થાય છે.  
શિવાળામાં નખળા માણસની ઉપર બરદનો પ્રયોગ કરવામાં  
જોખમ હોઈ શકે.

હવે ગરમ પાણીના ઉપયાર વિશે વિચારીએ. ગરમ પાણીના  
સમજપૂર્વક ઉપયોગથી ધણા રોગાની શાંતિ થઈ જાય છે. પ્રસિદ્ધ  
દ્વા આયોડિન જે કામ કરે છે તેમાંનું ધણુંખરું ગરમ પાણી કરે  
છે. સોજો હોય ત્યાં આયોડિન લગાડે છે. તે જ જગ્યાએ ગરમ  
પાણીનું પોતું ભૂડો તો આરામ થવાનો સંભવ છે. કાનમાં ફરદ  
થાય તો આયોડિનનાં ટીપાં નાખે છે. ત્યાં જ ગરમ પાણીની  
ચિચડારી મારવાથી શાંતિ થવાનો સંભવ છે. આયોડિનના  
ઉપયોગમાં કંઈક જોખમ છે, આમાં નથી. આયોડિન  
ડિસઇનફેક્ટર (જંતુનાશક) છે, તેમ જ ગરમ એટલે ઉકળતું  
પાણી ડિસઇનફેક્ટર છે. આનો અર્થ એમ સૂચવવાને સારુ નથી  
કે આયોડિન બહુ ઉપયોગી વસ્તુ નથી. એની ઉપયોગિતા વિશે  
મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ધેર તે હોતું નથી.

એ મોંધી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુગાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો અધાયને ત્યાં હોવાથી હવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી અચી જવું જેદીએ. આપણા ઘરમાં પડેલા ઉપાયો જાળવાથી આપણનું ઘણા લયોમાંથી ઉગરીએ છીએ.

વીછી જેને ઉંઘે છે તેને જ્યારે બીજુ કશી વસ્તુથી ઢાયકાં નથી થતો ત્યારે ઉખાયેલો ભાગ ગરમ પાણીમાં ઓળવાથી ને તેમાં રાખવાથી કંઈક આરામ તો મળે જ છે.

એકાએક ટાઠ ચેતે ત્યારે વરાળ આપવાથી ક દરહીના આસપાસ ગરમ પાણીવાળી ભાટલીઓ ગોઠવવાથી ને અરંઅર ઓદાવાથી તેની ટાઠ સમાવી શકાય છે. અધાની પાસે રખરની કંથળી નથી હંતી. કાચની મજબૂત ભાટલી, જેને મજબૂત બ્રૂચ હોય, તે અનું કામ આપે છે. કોઈ પણ ધાતુની ભાટલી, જેને અરંઅરનું બ્રૂચ લગાડાય, તે પણ સુંદર કામ આપે છે. ધાતુના ક બીજુ ભાટલી બહુ ગરમ જણાય તો તેને જડા કષ્ટામાં લંપદ્ધી જેદીએ.

વરાળડે પાણી બહુ કામ આપે છે. પરંસંવાં ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધિવાથી જેનું શરીર જલાઈ ગયેલું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સારુ વરાળ બહુ ઉપયોગી વસ્તુ છે.

વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે: શાળનો કે સીદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે, પણ પાટીનોથ ચાલે. તેની ઉપર ચોકાળ કે કામળ પાથરીને દરહીને તેની ઉપર સુવાડવો. ઉકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ભાટલાની નીચે મૂકવા. દરહીને એવી રીતે ટાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોયને અટકે, જેથી બહારની હવા ભાટલા નીચે ન જવા પામે.

આમ લપેટચા પછી ઘડા કે તપેલા પરનું ટાકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. ભરોભર વરાળ ન મળે તો પાણી અદલવાની

૧૭-૧૨-૪૨ ૪૩૨ પદ્શો. ભીજ ઘડામાં પાણી ઉકળતું હોય

તે ખાટલા નીચે મૂકવું. સાધારણ રીતે આપણામાં રિવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મૂકે છે અને તેની ઉપર ઉકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો દર રહ્યો હોય છે. એક તણખો પણ ઉદે ને કામળ કે કંઈક ચીજ બળે તો દરદીની જન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોલ છોડીને મેં સૂચવેલી રીતનો ઉપયોગ કરવો.

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભૂત્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઈ.

જેના પગ ઠંડા થઈ ગયા હોય, પગ કળતર થતી હોય; તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે એવા ઊંડા વાસણમાં સહન થઈ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભૂકો નાખીને પગ થોડી મિનિટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શરૂ છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળોખમ થયું હોય કે ગળું આવી ગયું હોય તો કીટલીમાં ઉકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઈ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભૂંગળી લગાડવાથી તે ભૂંગળી વાટે વરાળ સુખેથી લઈ શકાય છે. આ ભૂંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભૂંગળીમાં લગાડવાથી વધારે સગવડ પડે છે.

### ૩. આકાશ

આકાશનો જ્ઞાનપૂર્વક ઉપયોગ આપણે ઓળામાં ઓળિએ કરીએ છીએ. તેનું જ્ઞાન પણ આપણાને ઓળામાં ઓળું છે. આકાશ એટલે અવકાશ કહી શકાય. હિસેલાં વાહણાનું આવશે ન હોય ત્યારે આપણે જીએ નજર કરીએ તો અત્યંત રૂપકષે, રૂહર, આસમાની રંગનો ધૂમટ જોઈએ છીએ. તેને આપણે આકાશ નામ જાહીએ છીએ. તેનું બીજું નામ જ આસમાન છે ના? એ ધૂમટને એડા જ નથી. એ જેટલું હુર છે એટલું જ આપણી પાણે છે. આકાશની આપણે ઘેરાયેલા ન હોઈએ તો ગુગળાઈને મરી જઈએ. જ્યાં કહી નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે હુર હુર આસમાની રૂમ જોઈએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી જ શરૂ થાય છે, નહીં, તે આપણી અંદર પણ છે. પોલાણમાત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છું કે જે ખાલી હેખાય છે તે હવાથી બરેલું છે. આપણે હવાને નથી જોઈ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું કરાં છે? એ આકાશમાં જ વિહાર કરે છે ના? એટલે આકાશ આપણાને છોડી જ નથી શકતું. હવાને પંપ વતી ઘણે બાગે ખેંચી શકાય, પણ આકાશને કોણ ખેંચી શકે? આકાશને ભરી મૂકીએ છીએ ખરા, પણ તે અનંત હવાથી તેમાં ગમે તેટલા હેઠો હોય તે બધા સમાઈ જાય.

એ આકાશની મહેશ આપણે આરોગ્ય જળવવા ને ખોણું હોય તે મેળવવા સારુ લેવાની છે. હવાની વધારેમાં વધારે જરૂર છે, તેથી તે સર્વોચ્ચાપક છે. પણ હવા બીજી પહાથોની સરખામણીમાં ચ્ચાપક છે, સ્વતંત્ર રીતે નહીં. બૌતિકશાસ્ત્ર શીખવે છે કે, પૃથ્વીએ અમુક માઈલ પછી હવા નથી મળતી. એમ કહેવાય છે કે,

પૃથ્વીના જીવા જેવા જીવ હવાના આવરણની બહાર હોઈ જ ન શકે. આ વાત બરોબર હો યા ન હો, આપણે તો અહીં એટલું જ જાળવાનું છે કે, જેમ આકાશ અહીં છે તેમ મજકૂર આવરણની બહાર પાગ છે. એટલે સર્વોદ્યાપક તો આકાશ છે. પછી ભલે શાસ્ત્રીઓં સિદ્ધ કરે કે એ આવરણની ઉપર ઈથર નામનો પદાર્થ છે, અથવા બીજો કોઈ. તે પણ જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કાહી શકાય કે, જો ઈશ્વરનો લેદ જાણી શકાય તો આકાશના જાળાય.

અંધું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશો કરી શકીએ તેટલે અંશો આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદૂર અને અદૂર તત્ત્વની વરચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ. એટલે કે, જો ઘરમાર વિના ક વલ્લા વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણે ન પહોંચીએ, ભલે કરોડામાં એક જ પહોંચતો હોય, છતાં એ આદર્શને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તે તેને જેટલે અંશો પહોંચાય તેટલે અંશો આપણે સુખ, શાંતિ, ને સંતોષ ભોગવીશું. આ આદર્શને હું છેવટની હદ સુધી ૨જૂ કરી શકું તો મારે કહેવું જોઈએ કે, આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જ્ય તેને વિશે આપણે તટસ્થ રહીએ. એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કહી ન બનાવીએ. આપણી શક્તિ ને આપણા જ્ઞાન પ્રમાણે તેનો સદુપ્રયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે એકય સાધવા સારુ કરીએ.

આ વિચારશોહી પ્રમાણે આપણે જીવનાનુદ્દે, જીવાનિની ઉપયોગમાં પુષ્ટલા અવકાશ રાખીએ. કદલાની માત્રામાં બોલું રાચરચીલું જોવામાં આવે છે કે આરો કેવી ગારીની સમાજની તથા ગુંગળાઈ ભાય, એ વસ્તુઓનો ઉપયોગ ન કરશે. આરો કેવી એ બધાં ધૂળ અને જરૂરાંને ઓકણી કરનાના લાભની રાખાનું. આરી જે સ્થાનમાં હું વસ્તુ હું ત્યાં હું તો મારીએ કે આહું હું તેવી ખુરશીઓ, કબારો, મેળો, આડચીઓની સંબંધમાં માત્ર ન. તેવી ડીમતી જાજમો કેવળ ધૂળ ઓકણી કરે છે. તે જીવા જરૂરાંનું જી બની એ કામ ન હતું; છ-સાત આંશસંસ્કારના. એ આંશી આંશમાં ઓછી દસ રતલ ધૂળ તો નોકળી જ હશે. અને એ પાછી પોતાની જગ્યાએ આવી ત્યારે તેનો રૂપર્શ જ તથી લાગશે. હિંસ આ જાણનું હુમેશાં કરાય નહીં, કાન્તાં તેવી આલદા ઘટે જે જોકની આરેનત વધે. આ તો મારો તાજે અનુભબ લાખી મંદો. મારી મારી જીવનમાં તો આકાશની સાથે મેળ બાંધવા માત્રને એ અનેક ઉપાયિનોને ઓછી કરી છે. ઘરની સાહાઈ, વલણની સાહાઈ, જોડેઝીની સાહાઈ. એક શબ્દમાં ને આપણા વિષયને લગતી લાખામાં કાડીએ તો, મેં ઉત્તરોઉત્તર મોકળાશ વધારી, આકાશ સાથેનો સીખો સંભંધ વધાર્યો, અને એમ પણ કાડી શકાય કે, જેમ એ સંભંધ લખતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગલું, મારી શાંતિ વધી, સંતોષ વદ્યો, ને ધનેરછા સાવ મોળી પડી. જોસે આકાશની સાથે સંભંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે. અંતમાં તો મનુષ્ય ઓટલાનો જ માલિક બને છે, જેટલાનો તે પ્રતિક્રિય ઉપયોગ કરી શકે છે. ને તે પચાવી શકે છે, એટલે તેના ઉપયોગથી તે આગળ વધે છે. આમ બધાય કરે તો આ આકાશન્યાની જગતમાં અમાને સાર સ્થાન છે ને કોઈને સાંકડનો અનુભબ સરખો નહીં થાય.

તેથી મનુષ્યનું સૂવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઈએ.  
 ભીનાશ કે ટાઈથી અથવા પૂર્તું ઢાંકણ ભલે રાખે, એક છત્રી જેવું  
 ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી અધ્યોવખત તેની છત્રી અગળિત  
 તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઉધે ત્યારે  
 તે પ્રતિક્ષણ નવું દશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં  
 છતાં તેની આંખ અંજશે નહીં, શીતળતા  
 ૧૮-૧૨-'૪૨ ભોગવશે. તારાઓનો ભવ્ય સંધ કરતો જ  
 હેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન  
 કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદ્દી અપવિત્ર  
 વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે.

પણ જેમ આપણી આપવાસ આકાશ છે તેમ જ આપણી અંદર  
 છે. ચામડીમાં રહેલા એક એક છિદ્રમાં, બે છિદ્રોની વરચે જ્યાં  
 જ્યાં છે ત્યાં આકાશ છે. એ આકાશ - અવકાશને આપણે ભરી  
 મૂકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જે આપણે આપણો આહાર  
 જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે.  
 આપણને હંમેશાં ખખર નથી હોતી કે કચારે વધારે અથવા અયોગ્ય  
 અવાઈ ગયું છે. તેથી અઠવાડિયે, પખવાડિયે કે સગવડ પડે તેમ  
 અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જળવી શકાય. પૂરા  
 અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું ખાવાનું છોડી  
 દેશે તોપણ લાભ મેળવશે.

#### ૪. તેજ

જેમ આકાશાદિ તત્ત્વો વિના તેમ તેજ એટલે પ્રકાશ વિના પણ  
 મનુષ્યનો નિર્વાહ નહીં થઈ શકે. પ્રકાશમાત્ર સૂર્યની પાસેથી આવે  
 છે. સૂર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો  
 આપણે પૂરો ઉપયોગ નથી કરતા, તેથી પૂરું આરોગ્ય નથી

ભોગવતા. જેમ આપણે પાણીમાં સ્નાન કરી સાક થઈએ છીએ  
તેમ સૂર્યસ્નાન પણ કરી શકાય. નગળો માણસ, જેનું લોહી બગ્ગે  
ગણું છે, તે જો સવારનો તડકો નગ્ન હશામાં લે, તો તેની શીકાશ  
ને નગળાઈ જશે ને હોજરી મંદ હશે તો તે આપત થશે. આ  
સ્નાન સવારના, તાપ બહુ ન ચઢ્યો હોય ત્યારે લેવાનું છે. જેને  
ઉધાડે શરીર સૂતાં કે બેસતાં ઠંડી લાગે તે જોઈતું કપું ઓળીને  
સુઅં, બેસે ને જેમ શરીર સહન કરે તેમ કપું ખસેટે. નગ્ન  
સ્થિતિમાં આંટા પણ મારી શકાય. કોઈ ન હેણે એવી જગ્યા શોધી  
ત્યાં આ કિયા થઈ શકે. એવી સગવડ મેળાવવા દૂર જવું પડે,  
ને તેઠલો વખત ન હોય તો ગુહ્ય ભાગો ટાંકી શકાય એવી પાતળી  
લંગાંટી પહેરીને સૂર્યસ્નાન લેવાય. આવા સૂર્યસ્નાનથી ઘણા  
માણસોને ફાયદો થયો છે. ક્ષયના રોગમાં એનો બહોળો ઉપયોગ  
થાય છે. સૂર્યસ્નાન કેવળ નૈસર્જિક ઉપયારકોનો વિષય નથી રહ્યો.  
દાકલરાની હેણરેખ નીચે એવાં મકાનો બનાવવામાં આઠ્યાં છે કે  
જેમાં સૂર્યના કિરણો કાચની રક્ષા નીચે ઠંડી હવામાં પણ મળી  
રહે.

કટલીડ વાર ગૂમડાં થયાં હોય તે રૂજાતાં જ નથી. તેને સૂર્યસ્નાન  
આપવાથી તે રૂજાયાં છે.

પરસેવો લાવવા સારુ મેં દરદીઓને અગિયાર વાગ્યાના અળતા  
તાપમાં બુનાડ્યા છે ને તે પરસેવે રેખાંખ થયા છે. આવા તાપમાં  
સુવાડવા સારુ દરદીને માથે માટીના પાણી મૂકવો જોઈએ. તેની  
ઉપર ડળના કુ બીજાં મોટાં પાંદડાં મુકાય ક જેથી માથું ઠંકું અને  
સુરક્ષિત રહે. માથે સખત તડકો ન લેવો જોઈએ.

## ૫. વાયુ-હવા

જેમ ચાર તેમ આ પાંચમું તત્ત્વ પણ અત્યંત ઉપયોગી છે. જે પાંચ તત્ત્વનું પૂતળું બન્યું છે તેમાંના એકેય વિના મનુષ્ય નભી ન જ શકે. એટલે વાયુથી કોઈએ ઉરવું ન જોઈએ. જ્યાં જઈએ ત્યાં ઘરાંમા વાયુ અને પ્રકાશને આપણે અંધ કરી આરોગ્યને જોખમમાં નાખીએ છીએ. ખરું જેતાં બચપણથી જ હવાનો ઉર ન રાખતાં શીખ્યા હોઈએ તો શરીર હવાની આવજથી ટેવાઈ જય છે, ને શરદી સાંજેખમ આદિથી બચી જય છે. હવાના પ્રકરણમાં આ વિષય ઉપર કહેવાઈ ગયું છે, એટલે અહીં વાયુ વિશે વધારે કહેવાપણું રહેતું નથી.